

અલ્લ વઝીરતુલ્લ કરીમા
અને અન્ય મસ્નૂન દુઆઓ
તથા મુબારક રાતોની ઈબાદતો

★ અઝ ★
આ'લા હમરત ઈમામ અહમદ રઝા
મુહદિષે બરેલ્વી رضي الله عنه

★ સંપાદકો ★
મુહમ્મદ અનીસ નૂરી રઝવી-સૂરત
પટેલ શબીર અલી રઝવી-દયાદરા

★ પ્રકાશક ★ આવૃત્તિ-૪
સુન્ની દા'વતે ઈસ્લામી-દયાદરા શાખા
GRWB/058/Bharuch/02
મુ.પો. દયાદરા-૩૯૨૦૨૦, તા. જિ. ભરૂચ
ફોન : (૦૬૨૪૨) ૨૮૨૭૯૨, ૨૮૨૯૧૧
મો. ૯૮૨૪૪૮૬૪૪૩

અનુક્રમણિકા	
❖ અલ્લ વઝીરતુલ કરીમા	009
❖ સવાર સાંજની દુઆઓ	009
❖ હર બલાથી બચવા	010
❖ સળગવું, ડૂબવું, ચોરી...થી બચવા	012
❖ સાપ વીંછી, ઝેરી પ્રાણીઓથી બચવા	012
❖ ઝેર અને કાવત્રાથી બચવા	014
❖ કયામતમાં ખુદાને રાજી કરવા	014
❖ બલા અને દગાથી બચવા	015
❖ નુકસાનીથી બચવા	015
❖ જિન, શૈતાન અને આફતથી બચવા	016
❖ શહાદતનો દરજ્જો મેળવવા માટે	017
❖ ઈમાનની સાથે ખાત્મો થવા	018
❖ ઈમાનની, જાન, માલ, ઔલાદની રક્ષા	019
❖ રાત દિવસની નેઅમતોનો શુક્ર અદા કરવા	019
❖ શૈતાન અને તેના લશ્કરથી બચવા	020
❖ દોઝખથી આઝાદ થવા	021
❖ ઈબાદતનો હક્ક અદા કરવા	022
❖ કર્જ ભરપાઈ કરવા	023

અનુક્રમણિકા	
❖ દરેક કામની સફળતા માટે	023
❖ નેક કામની પ્રેરણા માટે	024
❖ ગુનાહોની માફી અને શહીદનો દરજ્જો	024
❖ દુનિયાની મુફલિસી, કબ્રની બીક, કયામતના ગભરાહટથી બચવા	026
❖ સવારના સમયની દુઆઓ અને અમલો	026
❖ દરેક કામની સફળતા અને શૈતાનથી સુરક્ષા	026
❖ શૈતાનના લશ્કર સામે ઢાલ	027
❖ ઝિંદા દિલી માટે	028
❖ પાગલપણ, કોઠ, અંધાપાથી બચવા	028
❖ તિલાવતે કુર્આન-અન્ય વિદો	029
❖ પાંચે વખતની નમાઝ પછી પઢવાની દુઆઓ	030
❖ મરતાંની સાથે જ જન્મત મેળવવા	030
❖ સમુદ્રના ફીણ જેટલા ગુનાહો માફ	030
❖ બેમિસાલ અમલ	031
❖ પરેશાનીથી બચવા	032
❖ પંજગંજ કાદરી	032

અનુક્રમણિકા	
❖ ફજર અને મગરિબની નમાઝ પછી	034
❖ ફજર અને અસરની નમાઝ પછી	035
❖ આફત અને શૈતાનથી બચવા	035
❖ દોઝખ પણ દુઆ કરે !	036
❖ ફજરની નમાઝ પછીની દુઆઓ	037
❖ અસંખ્ય ફાયદા	037
❖ હજ્જ અને ઉમરાનો સવાબ	039
❖ મગરિબની નમાઝ પછીના અમલો	040
❖ સલાતુલ્ અવ્વાબીન	040
❖ રાતના સમયના અમલો	041
❖ ઈશાની નમાઝ બાદ	042
❖ આફતોથી બચવા	044
❖ રાત્રે સૂતી વખતે	045
❖ જાદૂ, જિન અને ચોરથી બચવા	046
❖ જાગતાં જ ખુશી મેળવવા	046
❖ ધાર્યા સમયે જાગવા	047
❖ દરેક બલાથી મેહફૂઝ રહેવા	048

અનુક્રમણિકા	
❖ ઈમાનની સાથે ખાત્મા માટે	048
❖ નમાઝે તહજજુદ	050
❖ તસવ્વુરે શયખ	051
❖ અગત્યની ભલામણ	052
❖ અઘ્ય મરનૂન દુઆઓ	054
❖ રાત્રે સૂતી વખતે	056
❖ રાત્રે ઊંઘમાંથી જાગે ત્યારે	056
❖ સ્વપ્નમાં ડરી જતાં	056
❖ સવારે ઉઠતી વખતે	057
❖ જાજરૂમાં જતી વખતે	057
❖ જાજરૂથી બહાર આવીને	057
❖ વુઝૂ શરૂ કરે ત્યારે	058
❖ વુઝૂ કર્યા પછી	058
❖ દરેક ફર્ઝ નમાઝ પછી	059
❖ જમવાની શરૂઆતમાં	059
❖ જમ્યા પછી	060
❖ દા'વત જમ્યા પછી	060

અનુક્રમણિકા	
❖ દૂધ પીધા પછી	061
❖ નવાં કપડાં પહેરતી વખતે	061
❖ મુસીબતમાં અથવા મુત્યુ વખતે	061
❖ દુલ્હા દુલ્હનને મુબારકબાદી આપતાં	062
❖ પહેલી રાત્રે દુલ્હો દુલ્હનને જુએ ત્યારે	062
❖ સંભોગ વખતે	063
❖ ઈન્ઝાલ થાય ત્યારે	063
❖ ગુસ્લે જનાબતની નિયત	064
❖ મુસલમાન ભાઈને હસતો જુએ ત્યારે	064
❖ આઈનામાં જોતી વખતે	064
❖ કોઈ એહસાન કરે ત્યારે	064
❖ છીંક આવે ત્યારે	064
❖ ઘરમાંથી બહાર જતી વખતે	065
❖ ઘરમાં દાખલ થતી વખતે	065
❖ બજારમાં જતી વખતે	066
❖ બજારમાં ખરીદ વેચાણ વખતે	067
❖ માલ દોલતમાં બરકત માટે	067
❖ જો માલ ન વેચાતો હોય તો	068

અનુક્રમણિકા	
❖ બીમારને જોઈને	068
❖ તાવની દુઆ	069
❖ બદ્નઝરની દુઆ	069
❖ કોઈપણ બીમારીમાં પઢવાની દુઆ	069
❖ સૂરમો નાખતી વખતે	070
❖ નવો ચાંદ જોઈને	070
❖ મરઘાનો અવાજ સાંભળીને	071
❖ ગધેડા અથવા કૂતરાનો અવાજ સાંભળે ત્યારે	071
❖ દુશ્મનનો ભય હોય ત્યારે	071
❖ મુસાફરીની દુઆ	072
❖ કબ્રસ્તાનમાં જાવ ત્યારે	073
❖ અઝાન પછીની દુઆ	073
❖ જ્યારે કોઈ વાત મરજી પ્રમાણે બને ત્યારે	074
❖ જ્યારે કોઈ વાત મરજી વિરુદ્ધ બને ત્યારે	074
❖ શૈતાની વસવસાથી બચવા	075
❖ કેટલાક વિદો વઝાઈફ	075
❖ યા ગનીઅુ—યા નાફિઅુ	075
❖ ચિંતા, રંજ ગમથી બચવા	075

અનુક્રમણિકા	
❖ રોજની પરેશાની દૂર કરવા	076
❖ રોજમાં બરકત અને કબ્રના અઝાબથી બચવા	077
❖ આફત બલાથી બચવા	078
❖ અલ્લાહની નજીક સૌથી પ્યારી વાત	079
❖ સરકાર <small>صلى الله عليه وسلم</small> ના માટે	079
❖ દિવસમાં ફક્ત એકવાર	080
❖ દિવસમાં ૨૭ વખત	080
❖ શહાદત મેળવવા	081
❖ મર્ઝલ મૌતની દુઆ	081
❖ ફજર તથા મગરિબ પછી	082
❖ ખાત્મા બિલ્ ખેરની દુઆ	083
❖ મુબારક રાતોની ઈબાદતો	084
❖ યૌમે આશૂરાની ઈબાદતો	084
❖ શબે મેઅરાજની ઈબાદતો	093
❖ ફઝાઈલે શાબાનુલ્ મુઅઝ્ઝમ	095
❖ શબે કદ્રના ફઝાઈલ તથા નવાફિલ	103

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
نَحْمَدُهُ وَنُصَلِّي عَلَى رَسُولِهِ الْكَرِيمِ

અહલે ઈસ્લામના જીવનની તકલીફો આસાન કરવા તથા મો'મિનોના દરજ્જાઓને બુલંદ કરવા માટે કુર્આનની આયતો અને હદીષોની રિવાયતોની મસ્નૂન દુઆઓ કે જેને આ'લા હઝરત ફાઝિલે બરેલ્વી رضي الله عنه એ પોતાના રોજિંદા વઝાઈફમાં અપનાવેલી તે દુઆઓના મજમૂઆનું ગુજરાતીમાં રૂપાંતર.....એટલે.....

અલ્ વઝીફુલ હરીમા

(પ્રકરણ : ૧)

★ સવાર સાંજ બંને સમયની દુઆઓ ★

અહીં સવારે અને સાંજે પઢવાની દુઆઓ દર્શાવવામાં આવે છે.

સવાર : એટલે અડધી રાત પસાર થયા પછી સૂર્યોદય સુધીનો સમય સવારમાં ગણવામાં આવશે. તે સમય દરમ્યાન જે જે દુઆઓ પઢવામાં આવશે તે સવારના પઢી છે, તેમ ગણાશે.

સાંજ : એટલે બપોરે સૂરજ નમ્યા પછી સૂર્યાસ્ત સુધીનો સમય સાંજમાં ગણવામાં આવશે તે સમય દરમ્યાન જે જે દુઆઓ પઢવામાં આવશે તે સાંજના પઢી છે, તેમ ગણાશે.

★ હર બલાથી બચવા ★

سُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللَّهِ مَا شَاءَ اللَّهُ كَانَ وَمَا لَمْ يَشَاءَ لَمْ يَكُنْ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ وَأَنَّ اللَّهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَيْءٍ عِلْمًا

(૧) સુબહાનલ્લાહિ વ બિહમ્દિહી વલા હવ્લ વલા કુવ્વત ઈલ્લાહિલ્લાહિ માશા અલ્લાહુ કાન વ માલમ્ યશાઅ્ લમ યકૂન્ અઅ્લમુ

અન્નલ્લાહ અલા કુલ્લિ શયઈન કદીરુવ વ અન્નલ્લાહ કદ્ અહાત બિ કુલ્લિ શયઈન ઈલ્મા. એક એક વખત.

(૨) આયતુલ કુર્સી :-

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَّةٌ وَلَا نَوْمٌ لَهُ مَا فِي السَّمَوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمَوَاتِ وَالْأَرْضَ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ

એક એક વખત અને ત્યારબાદ :-

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
اللَّهُ الْعَزِيزُ الْعَلِيمُ ۝ غَا فِرَالِدُنَّب وَقَابِلِ التَّوْبِ شَدِيدِ الْعِقَابِ ذِي الطُّوْلِ ۚ لَا إِلَهَ إِلَّا هُوَ إِلَهُ الْمَصْبُورِ

બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહિમ હા મીમ તન્ઝીલુલ્ કિતાબિ મિનલ્લાહિલ્ અઝીઝિલ્ અલીમ. ગાફિરઝઝમ્બિ કાબિલિત્તૌબિ શદીહિલ્ ઈકાબિ મિત્તૌલિ લા ઈલાહ ઈલ્લા હુવ ઈલેહિલ્ મસીર. એક એક વખત.

(૩) ત્રણેવ કુલ ત્રણ ત્રણ વાર.

નોંધ : ઉપરોક્ત ત્રણેય નંબર સુધીની દુઆઓ પઢનાર હર બલા આફતથી સલામત રહેશે.

સવારે પઢી લેવાથી સાંજ સુધી અને સાંજે પઢી લેવાથી સવાર સુધી સલામત રહેશે.

★ સળગવું, ડૂબવું, ચોરી, સાપ,
વીંછી, શૈતાન અને હાકિમથી
સલામત રહેવા ★

بِسْمِ اللَّهِ مَا شَاءَ اللَّهُ لَا يَسْمُوقُ الْحَبِيرَ إِلَّا اللَّهُ
مَا شَاءَ اللَّهُ لَا يَصْرِفُ السُّوءَ إِلَّا اللَّهُ مَا شَاءَ اللَّهُ
مَا كَانَ مِنْ رِعْمَةٍ فَمِنَ اللَّهِ مَا شَاءَ اللَّهُ لَأَحُولَ
وَلَأَقْوَمُ إِلَّا بِاللَّهِ

બિસ્મિલ્લાહિ માશાઅલ્લાહુ લા યસૂકુલ ખેર
ઈલ્લલ્લાહુ માશાઅલ્લાહુ લા યસ્રિફૂસ્સૂઅ
ઈલ્લલ્લાહુ માશાઅલ્લાહુ મા કાન મિન્નિઅમતિન્
ફમિનલ્લાહિ માશાઅલ્લાહુ લા હવ્લ વલા કુવ્વત
ઈલ્લા બિલ્લાહ. ત્રણ વખત પઢવું.

★ સાપ, વીંછી અને ઝેરી
પ્રાણીઓથી બચવા ★

أَهْوَذُ بِكَلِمَاتِ اللَّهِ الثَّمَنَاتِ مِنْ شَرِّ مَا خَلَقَ

13

અભિમુ બિ કલિમાતિલ્લાહિ તામ્માતિ
મિનશરિ મા ખલક. ત્રણ વખત પઢવું.

★ ઝેર અને કાવત્રાથી બચવા ★

بِسْمِ اللَّهِ الَّذِي لَا يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ
فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ

બિસ્મિલ્લાહિલ્ લગી લાયદૂરુ મઅઈસ્મિહિ
શયઊિન્ ફિલ્ અઈિ વલા ફિસ્સાઈ વ
હુવસ્સમીઈલ્ અલીમ. ત્રણ વખત પઢવું.

★ કયામતમાં ખુદાને રાખી કરવા ★

رَضِيْتُ بِاللَّهِ رَبًّا وَبِالْإِسْلَامِ دِينًا وَبِسَيِّدِنَا
وَمَوْلَانَا مُحَمَّدٍ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ
نَبِيًّا وَرَسُولًا

રદીતુ બિલ્લાહિ રબ્બન્ વ બિલ્ ઈસ્લામિ
દીનન્ વબિ સચિયદિના વ મૌલાના મુહમ્મદિન્
સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ નબીયન્
વ રસૂલા. ત્રણ વખત પઢવું.

14

★ બલા અને દગાથી બચવા ★

حَسْبِيَ اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ عَلَيْهِ تَوَكَّلْتُ
وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ

હસ્બિઅલ્લાહુ લા ઈલાહ ઈલ્લા હવ, અલૈહિ
તવક્કલતુ વ હુવ રબ્બુલ અર્શિલ્ અઝીમ.
દસ-દસ વખત પઢવું.

ઉપરોક્ત દુઆને સાત, સાત વખત પઢવાનું
હદીષમાં વર્ણન છે જ્યારે હુઝૂર સૈયદના ગૌષે આ'ઝમ
رضی اللہ عنہ દસ-દસ વખત પઢવાનું ફર્માવેલ છે.
ફકીરનો (આ'લા હઝરતનો) એના પર અમલ છે, એને
બિહમ્દિહી તઆલા તમામ મકસદો માટે પૂરતો જોયો.

★ ગુકસાનીથી બચવા ★

فَسُبْحَانَ اللَّهِ حِينَ تُمْسُونَ وَحِينَ تُصْبِحُونَ
وَلَهُ الْحَمْدُ فِي السَّمَوَاتِ وَالْأَرْضِ وَعَشِيًّا
وَحِينَ تَنْظُرُونَ ط يُجْرِبُ الَّذِي مِنَ النَّبِيِّتِ

15

وَيُجْرِبُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَيُجْبِي الْأَرْضَ بَعْدَ
مَوْتِهَا وَكَذَلِكَ تَخْرُجُونَ

ફ સુબ્હાનલ્લાહિ હીન તમ્સૂન વ હીન
તુસ્બિહૂન વ લહુલ્ હમ્દુ ફીસ્સમાવાતિ વલ્
અઈ વ અશિચ્યન્ વ હીન તુઝહિરૂન. યુષ્ફિજુલ્
હચ મિનલ્ મચિયતિ વ યુષ્ફિજુલ્ મચિયત
મિનલ્ હચિય વ યુહયીલ્ અઈ બઅદ મૌતિહા
વ કઝાલિક તુષ્ફૂન. (એક વખત પઢવું)

(ઉપરોક્ત વિદિ પઢવાથી રાત અને દિવસના
દરેક નુકસાનથી સુરક્ષિત રહેશે.)

★ જિન, શૈતાન અને આફતથી
બચવા ★

أَفْحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا.....
(સૂરત પૂરી થતી સુદી)

અ-ફ-હસિબતુમ્ અન્નમા ખલકનાકુમ્
અબષવ્ વ અન્નકુમ ઈલેના લા તુરજઊિન ★

16

ફતઆલલાહુલ મલિકુલ્ હક્કુ લા ઈલાહ ઈલ્લાહુ વ વ ૨૦બુલ્ અશિલ કરીમ ★ વ મંચ્ ચદઊ મઅલ્લાહિ ઈલાહન્ આખર લા બુહાન લહુ બિહિ ફ ઈન્નમા હિસાબુહુ ઈન્દા રહિબિહિ ઈન્નહુ લા ચુફલિહુલ્ કાફિરન ★ વ કુરુબિગ્ ફિર્ વર્હમ વ અન્ત ખચરુર રાહિમીન. (એક વખત પઢવું)

★ શહાદતનો દરજ્જો મેળવવા માટે ★

أَعُوذُ بِاللَّهِ السَّيِّدِ الْعَلِيِّ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ

★ અઊમુબિલ્લાહિ-રસમીઇલ અલીમિ મિનશયતાનિર્જુમ. (ત્રણ વખત પઢવું)

هُوَ اللَّهُ الَّذِي لَا إِلَهَ إِلَّا هُوَ.....

(સૂરએ હશ્રની અંતિમ ત્રણ આયતો.)

★ હુવલ્લાહુલ્ લગી લા ઈલાહ ઈલ્લાહુ આલિમુલ્ ગયબિ વશહાદતિ હુવર્હમાનુર્હીમ

★ હુવલ્લાહુલ્ લગી લા ઈલાહ ઈલ્લાહુ અલ્

17

મલિકુલ્ કુદુસુસલામુલ મુઅમિનુલ્ મુહયમિનુલ્ અઊમુલ ૪૦બારુલ્ મુતકબિર સુબ્હાનલ્લાહિ અમ્મ યુશરિકૂન ★ હુવલ્લાહુલ્ ખાલિકુલ્ બારિઊલ મુસવિરુ લહુલ્ અસ્માઉલ હુસ્ના યુસબિહુ લહુ મા ફિસ્સમાવાતિ વલ્ અઈ વ હુવલ્ અઊમુલ્ હકીમ. (એક વખત પઢવું)

ઉપરોક્ત વિદ્ કરનાર જો સવારે પહે તો સાંજ સુધી અને સાંજે પહે તો સવાર સુધી તેના માટે સિત્તેર હજાર (૭૦,૦૦૦) ફરિશ્તાઓ મગફિરતની દુઆ કરશે.

અને.. જો તે દિવસે તેનો ઈન્તેકાલ (મૃત્યુ) થશે તો તે વિદ્ કરનારને "શહીદ"નો મર્તબો મળશે.

★ ઈમાનની સાથે ખાત્મો

થવા માટે ★

اللَّهُمَّ إِنَّا نَعُوذُ بِكَ مِنْ أَنْ نُشْرِكَ بِكَ شَيْئًا نَعْلَمُهُ وَنَسْتَغْفِرُكَ لِمَا لَا نَعْلَمُهُ

18

અલ્લાહુમ્મ ઈન્ના નઊમુબિક મિન્ અન્ નુશરિક બિક શયઅન્ નઅલમુહુ વ નસ્તગ્ફરુક લિમાલા નઅલમુહુ. (ત્રણ વખત પઢવું.)

ઉપરોક્ત વિદ્ કરનારનો ખાત્મો ઈન્શાઅલ્લાહ ઈમાનની સાથે થશે.

★ ઈમાન, જાન માલ અને બાલ બચાંની સલામતી માટે ★

بِسْمِ اللَّهِ عَلَى دِينِي بِسْمِ اللَّهِ عَلَى نَفْسِي وَوَلَدِي
وَأَهْلِي وَمَالِي

બિસ્મિલ્લાહિ અલા દીની બિસ્મિલ્લાહિ અલા નફ્સી વ વલદી વ અહ્લી વ માલી. (ત્રણ વખત પઢવું)

★ રાત દિવસની નેઅમતોનો

શુક્રિયા અદા કરવા ★

اللَّهُمَّ مَا أَصْبَحَ مِنْ نِعْمَةٍ أَوْ بَاحِدٍ مِنْ خَلْقِكَ

19

فَمِنْكَ وَحَدِّكَ لَا شَرِيكَ لَكَ فَكَالْحَمْدُ وَ
وَلِلَّ الشُّكْرُ

لَا إِلَهَ إِلَّا أَنْتَ سُبْحَانَكَ إِنِّي كُنْتُ مِنَ الظَّالِمِينَ

અલ્લાહુમ્મ-મા-અરબહ મિન્ નિઅમતિન્ અવબિ અહદિમ્ મિન્ ખલ્કિક ફમિન્ક વહદક લા શરીક લક ફ લકલ્ હમ્દુ વ વલકશ્શુકુ. લાઈલાહ ઈલ્લા અન્ત સુબ્હાનક ઈન્ની કુન્તુ મિનઝ્ઝાલિમીન. (એક વખત પઢવું.)

નોંધ : ઉપરોક્ત દુઆ સાંજે પઢતી વખતે અમ્સી મા-અરબહની જગ્યાએ અમ્સી મા-અમ્સા પઢવું.

★ શયતાન અને તેના લશ્કરથી

બચવા ★

بِسْمِ اللَّهِ ذِي الشَّانِ عَظِيمِ الْوَهَّانِ شَلِيدِ
السُّلْطَانِ مَا سَأَاءَ اللَّهُ كَانَ أَعُوذُ بِاللَّهِ مِنَ
الشَّيْطَانِ الرَّجِيمِ

20

બિસ્મિલ્લાહિ-મીશાનિ અઝીમિલ્ બુરહાનિ શદીદિ-રસુલતાનિ માશાઅલ્લાહુ કાન અઊમુ બિલ્લાહિ મિન-શયતાનિર્જુમ. (એક વખત પઢવું.)

★ દોઝખથી આઝાદ થવા માટે ★

اللَّهُمَّ إِنِّي أَصْبَحْتُ أُشْهِدُكَ وَأَشْهَدُ حِمْلَةَ عَرْشِكَ وَمَلَأْتَكَتِكَ وَجَمِيعَةَ خَلْقِكَ إِنَّكَ أَنْتَ اللَّهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ وَحَدِّكَ لَا شَرِيكَ لَكَ وَأَنَّ مُحَمَّدًا عَبْدُكَ وَسَيِّدُكَ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْكَ وَسَلَّمَ

અલ્લાહુમ્મ ઈન્ની અરબહતુ ઉશહિદુક વ ઉશહિદુ હમલત અશિક વ મલાઈકતક વ જમીઅ ખલ્કિક ઈન્નક અન્તલ્લાહુ લા ઈલાહ ઈલ્લા અન્ત વહદક લા શરીક લક વ અન્ન મુહમ્મદન્ અબ્દુક વ રસૂલુક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ. (ચાર વખત પઢવું.)

નોંધ : ઉપરોક્ત દુઆ સાંજે પઢતી વખતે

અરબહતુની જગ્યાએ અમ્મા પઢવું.

★ ઈબાદતનો ફક્ક અદા કરવા માટે ★

اللَّهُمَّ لَكَ الْحَمْدُ حَمْدًا أَذْأَسْمَاءَ دَوَائِمِكَ وَلَكَ الْحَمْدُ حَمْدًا أَحَالَ اللَّهُ خَلْقُوكَ وَلَكَ الْحَمْدُ حَمْدًا الرَّامْتَلِي لَهُ دُونَ مَسِيَّتِكَ وَ لَكَ الْحَمْدُ حَمْدًا عِنْدَ كُلِّ طَرْفَةِ عَيْنٍ وَتَنْفَسٍ كُلِّ نَفْسٍ ط

અલ્લાહુમ્મ લકલ્ હમ્દુ હમ્દન્ દાઈમન્ મઅઅ દવામિક વ લકલ્ હમ્દુ હમ્દન્ ખાલિદમ્ મઅ ખુલૂદિક વ લકલ્ હમ્દુ હમ્દલ્ લા મુન્તહા લહૂ દૂન મશિયતિક વ લકલ્ હમ્દુ હમ્દન્ ઈન્દ કુલ્લિ તર્ફતિ અયિન્ વ તનફ્ફસિ કુલ્લિ નફ્ફસિન્. (એક વખત પઢવું.)

ઉપરોક્ત દુઆ પઢનારે રાત દિવસની પૂરી ઈબાદતનું હક્ક અદા કર્યું ગણાશે.

★ કર્મ ભરપાઈ કરવા માટે ★

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْهَمِّ وَالْحُزْنِ وَأَعُوذُ بِكَ مِنَ الْعَجْزِ وَالْكَسَلِ وَأَعُوذُ بِكَ مِنَ الْجُبْنِ وَالْبُخْلِ وَأَعُوذُ بِكَ مِنْ غَلَبَةِ الدَّيْنِ وَقَهْرِ الرِّجَالِ

અલ્લાહુમ્મ ઈન્ની અઊમુ બિક મિનલ્ હમ્મિ વલ્ હુઝ્નિ વ અઊમુ બિક મિનલ્ અજ્જિ વલ્ કસિલ વ અઊમુબિક મિનલ્ જુબ્નિ વલ્ બુખ્લિ વ અઊમુ બિક મિન્ ગલબતિદ્ દયનિ વ કહરિ-રિજાલ્. (અગ્યાર વખત પઢવું.)

★ દરેક કામની સફળતા માટે ★

يَا حَسْبِي يَا قِيَوْمَ بِرَحْمَتِكَ أَسْتَغِيثُ فَلَا تُكَلِّبْنِي إِلَى نَفْسِي طَرْفَةَ عَيْنٍ وَأَصْلِحْ لِي شَأْنِي كُلَّهُ

યા હસ્યુ યા કર્યુમુ બિ રહ્મતિક

અસ્તગીધુ ફલા તકિલ્ની ઈલા નફ્ફસી તર્ફત અયિન્ વ અસ્લિહ લિ શાની કુલ્લુહુ. (એક વખત પઢવું.)

★ નેક કામની પ્રેરણા માટે ★

اللَّهُمَّ خَيْرِي وَأَحْسَنِي وَلَا تُكَلِّبْنِي إِلَى خَيْرِي

અલ્લાહુમ્મ ખિર્લી વખ્તલી વલા તકિલ્ની ઈલા ઈખ્તિયારી. (સાત વખત પઢવું.)

ઉપરોક્ત દુઆ રાત દિવસના દરેક કામ માટે ઈસ્તેખારો છે.

સચ્ચિદુલ્ ઈસ્તિમશાર એટલે.....

★ ગુનાહોની માફી અને શહીદનો દરજ્જો ★

اللَّهُمَّ أَنْتَ رَبِّي لَا إِلَهَ إِلَّا أَنْتَ خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ وَأَنَا عَلَى عَهْدِكَ وَ وَعْدِكَ مَا اسْتَطَعْتُ أَعُوذُ بِكَ مِنْ شَرِّ

مَا صَنَعْتَ أَبُوءُ لَكَ بِعَمَّتِكَ عَلِيٍّ وَأَبُوءُ لَكَ
بِدَائِي وَمَا عَمَّرِي فَيَا نَسْتُ لَا يُعْفِرُ الدُّنُوبَ
إِلَّا أَنْتَ

અલ્લાહુમ્મ અન્ત રબ્બિ લા ઈલાહ ઈલ્લા
અન્ત ખલકતની વ અના અબ્દુક વ અના
અલા અહદિક વ-વઅદિક મસ્તતઅતુ
અઊમુબિક મિન-શરિ મા સનઅતુ અબૂઉ
લક બિ નિઅમતિક અલચ્ય વ અબૂઉ લક
બિ ઝંબી ફગ્ફિલી ફ ઈન્નહુ લા યગ
ફિરૂઝ મુનૂબ ઈલ્લા અન્ત. વગ્ ફિર લિ
ફુલ્લિ મુઅમિનિવ્ વ મુઅમિનતિન્.

એક વખત પઢવું. કોઈનાથી નુકસાનનો ભય
હોય તે એને પઢે તો મૌલા તઆલા મેહફૂઝ રાખે
છે.

★ નોંધ : આ વિદે ત્રણ વખત પઢવું વધુ
અફઝલ છે.

28

★ દુનિયાની મુફલિસી, કલ્બની
બીક અને કયામતના
ગભરાહટથી બચવા ★

لَا إِلَهَ إِلَّا اللَّهُ الْمَلِكُ الْحَقُّ الْمُبِينُ

લા ઈલાહ ઈલ્લાહુલ્ મલિકુલ્ હક્કુલ્
મુબીન. સો વખત પઢવું.

(પ્રકરણ : ૨)

★ સવારના સમયની દુઆઓ
અને અમલો ★

અહીં ફક્ત સવારના સમયની દુઆઓ અને
અમલોનું વર્ણન કરવામાં આવે છે. જેના ઉપર અમલ
કરવાથી ઈ-શાઅલ્લાહ ! અસંખ્ય ફાયદા થશે.

★ દરેક કામની સફળતા અને
શૈતાનથી સુરક્ષા ★

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ

28

إِلَّا بِاللَّهِ الْعَلِيِّ الْعَظِيمِ

બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ વલા હવ્લ વલા
ફુવ્વત ઈલ્લાબિલ્લા હિલ્ અલિચ્ચિલ્ અઝીમ.
બને તેટલી વખત પઢવું.

ઉપરોક્ત વિદે કરનારનાં દરેક કામ સફળ થશે
અને શૈતાનના ફરેબથી સલામત રહેશે.

★ શૈતાનના લશ્કર સામે ઢાલ ★

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ ○ اللَّهُ الصَّمَدُ ○ لَمْ
يَلِدْ ○ وَلَمْ يُولَدْ ○ وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا
○ أَحَدٌ

ફુલ્હુવલ્લાહુ અહદ અલ્લાહુર્રસમદ લમ્
યલિદ વલમ યુલદ વલમ્ યફુલ્લાહુ ફુફૂવન્
અહદ. અગ્યાર વખત પઢવું.

ઉપરોક્ત વિદે કરનાર શૈતાનથી મેહફૂઝ રહેશે.

27

જો શૈતાન પોતાના લશ્કરને લઈને આવે અને તે
શખ્સને ખરાબ કરવા માટે પ્રેરવાની કોશિશ કરે તો
પણ શૈતાન કામ્યાબ નહીં થાય.

★ ઝિંદા દિલી માટે ★

يَا حَيُّ يَا قَيُّوْمُ لَا إِلَهَ إِلَّا أَنْتَ

યા હય્યુ યા કય્યુમુ લા ઈલાહ ઈલ્લા
અન્ત. એકતાલીસ વખત પઢવું.

★ પાગલપણું, કોટ અને
અંધાપાથી બચવા ★

سُبْحَانَ اللَّهِ الْعَظِيمِ وَبِحَمْدِهِ

સુબ્હાનલ્લાહિલ્ અઝીમ વબિ હમ્દિહી. ત્રણ
વખત પઢવું.

ઉપરોક્ત વિદે કરનાર પાગલપણા, કોટ અને
આંખના અંધાપાથી મેહફૂઝ રહેશે.

28

★ તિલાવતે કુર્આન ★

દરરોજ સવારે કુર્આન શરીફ ઓછામાં ઓછો એક સિપારો પઢવું અને એક સિપારાથી વધુ પઢવામાં ઘણી જ ફજીલત છે. શક્તિ પ્રમાણે વધુમાં વધુ જેટલો પણ પઢવામાં આવે બેહતર છે.

સૂરજ ઊગી રહ્યો હોય (સૂર્યોદય) ત્યારે કુર્આન શરીફની તિલાવત ન કરવી. તે સમયે ઝિક્રે ખૈર કરવું જોઈએ ત્યાં સુધી કે સૂરજ ક્ષિતિજમાં ઊંચે ચડી જાય, એટલે કે સૂર્યોદય થયા પછી ૨૦ (વીસ) મિનિટ સુધી તિલાવત ન કરવી. ત્યારબાદ તિલાવત કરવી કેમ કે તે સમયે તિલાવત કરવી મકરૂહ છે.

★ અન્ય વિદો ★

સવારના સમયે દલાઈલુલ ખૈરાતનો એક હિઝબ (મંઝિલ) અને શજરા શરીફ પઢવું ઘણું અફઝલ છે.

(પ્રકરણ : ૩)

★ પાંચેય વખતની નમાઝ પછી પઢવાની દુઆઓ ★

અહીં દરેક વખતની નમાઝ પછી પઢવાની દુઆઓ અને વિદોનું વર્ણન કરવામાં આવે છે જેના ઉપર અમલ કરવાથી ઈ-શાઅલ્લાહ અસંખ્ય ફાયદાઓ પ્રાપ્ત થશે.

★ મરતાની સાથે જ જન્નત મેલવવા ★

દરેક નમાઝ પછી આચતુલ કુર્સી એક એક વખત પઢવું જેની બરકતથી ઈ-શાઅલ્લાહ ! મરતાની સાથે જ જન્નતમાં પ્રવેશ મળશે.

★ સમુદ્રના ફીણ જેટલા ગુનાહો પણ માફ કરાવવા ★

أَسْتَغْفِرُ اللَّهَ الَّذِي لَا إِلَهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ
وَأَتُوبُ إِلَيْهِ

અસ્તગફિરુલ્લાહલ્લાઝી લા ઈલાહ ઈલ્લાહુવલ્ હય્યુલ્ કય્યુમ્ વ અતૂબુ ઈલૈહ. ત્રણ વખત પઢવું.

★ બેમિસાલ અમલ ★

દરેક નમાઝ પછી તસ્બીહે હઝરત સય્યિદતિના ફાતિમુઝ્ઝોહરા رضی اللہ عنہا પઢવું અને તે તસ્બીહ નીચે મુજબ છે.

33 વખત "સુબ્હાનલ્લાહ"

33 વખત "અલ્હમ્દુલિલ્લાહ"

38 વખત "અલ્લાહુ અકબર"

لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
الْمَلِكُ وَالْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ

લા ઈલાહ ઈલ્લાહુ વહ્દહૂ લા શરીફ લહુ ★ લહુલ્ મુલ્કુ વલહુલ્ હમ્દુ વ હુવ અલા કુલ્લિ શયઈન્ કદીર. (એક વાર પઢવું.)

ઉપરોક્ત વિદ કરનારના અમલ એટલા બુલંદ થશે કે વિ□માં તેની સમાન બીજા કોઈના અમલ બુલંદ નહીં થાય.

★ પરેશાનીથી બચવા ★

કપાળ ઉપર જમણો હાથ રાખીને :-

بِسْمِ اللَّهِ الَّذِي لَا إِلَهَ إِلَّا هُوَ الرَّحْمَنُ الرَّحِيمُ اللَّهُمَّ
أَذْهِبْ عَنِّي الْهَمَّ وَالْحُزْنَ وَعَنْ أَهْلِ السُّنَّةِ

બિસ્મિલ્લાહિલ્ લઝી લા ઈલાહ ઈલ્લાહુવર્દ્દમાનુર્દ્દીમિ અલ્લાહુમ્મ અઝ્હિબ્ અન્નિલ્ હમ્મ વલ્ હુઝ્ન. વ અન્ અહ્લિસ્સુન્નતિ. (એક વખત પઢવું.)

ઉપરોક્ત વિદ કરનાર દરેક રંજ અને પરેશાનીથી મેહફૂઝ રહેશે.

★ પંજ ગંજ કાદરી ★

દરેક નમાઝ પછી, અવ્વલ-આખિર

ત્રણ-ત્રણ વખત દુરુદ શરીફ પઢી નીચે દર્શાવેલ વિર્દ કરવાથી અસંખ્ય દીની અને દુનિયવી બરકતો પ્રાપ્ત થશે.

★ ફજરની નમાઝ પછી :-

"યા અઝીઝુ યા અલ્લાહ" [સો (૧૦૦) વખત]

★ ઝોહરની નમાઝ પછી :-

"યા કરીમુ યા અલ્લાહ" [સો (૧૦૦) વખત]

★ અસરની નમાઝ પછી :-

"યા જબ્બારુ યા અલ્લાહ" [સો (૧૦૦) વખત]

★ મગરિબની નમાઝ પછી :-

"યા સત્તારુ યા અલ્લાહ" [સો (૧૦૦) વખત]

★ ઈશાની નમાઝ પછી :-

"યા ગફ્ફારુ યા અલ્લાહ" [સો (૧૦૦) વખત] વિશેષમાં.....

★ ફજર અને મગરિબની

નમાઝ પછી ★

★ હસ્બિયલ્લાહુ લા ઈલાહ ઈલ્લા હુવ ઈલેહિ તવક્ક્લુ વ હુવ રબ્બુલ્ અર્શિલ્ અઝીમ. (દસ વખત પઢવું.)

★ રબ્બિ ઈન્ની મસ્સનિય દ દુરુ વ અન્ત અર્હમુરાર્હિમીન. (દસ વખત પઢવું)

★ રબ્બિ ઈન્ની મગ્લૂબુન ફન્તસિર. (દસ વખત પઢવું)

★ રાયુહ ઝમુલ જમ્ઓ વ ચુવલ્લૂનદ દુબૂર. (દસ વખત પઢવું.)

★ અલ્લાહુમ્મ ઈન્ન નઝઅલુક ફી નહુરિ હિમ વ નઊમુબિક મિન શુર્રિહીમ. (દસ વખત પઢવું.)



(પ્રકરણ : ૪)

★ ફજર અને અસરની નમાઝ પછીની દુઆઓ ★

અહીં ફજર અને અસરની નમાઝ પછી પઢવાની દુઆઓનું વર્ણન કરવામાં આવે છે. નીચે દર્શાવેલા અમલો ફજર અને અસરની નમાઝ પછી પઢવા.

★ આફત અને શૈતાનથી બચવા ★

ફજર અને અસરની ફર્જ નમાઝની સલામ ફેરવ્યા બાદ, તે જ સ્થિતિમાં બેઠા રહેવું પગ બદલવા નહીં અને કોઈની સાથે વાતચીત પણ કરવી નહીં અને :-

لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ يَدِيهِ الْخَيْرُ يُحْيِي وَ يُمِيتُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ

લા ઈલાહ ઈલ્લાહુ વહ્દહૂ લા શરીક લહુ લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ બિ ચદિહિલ્ બયરુ ચુહ્યી વ ચુમીતુ વ હુવ અલા કુલ્લિ શાયઈન કદીર. દસ વખત પઢવું.

ઉપરોક્ત વિર્દ કરનાર દરેક બલા, આફત, શૈતાન અને મકરૂહાતથી બચતો રહેશે, તેના ગુનાહ માફ થશે અને તેની નેકીઓ બીજાઓની નેકીઓથી વધી જશે.

★ દોઝખ પણ દુઆ કરે ! ★

ઉપર દર્શાવેલ અમલ પઢી લીધા પછી, તરત જ :

اللَّهُمَّ اجْرِني مِنَ السَّارِطِ

અલ્લાહુમ્મ અર્જિની મિનન્નાર. સાત વખત પઢવું.

ઉપરોક્ત વિર્દ કરનાર માટે ખૂદ જહન્નમ પણ દુઆ માંગશે કે ઈલાહી ! તે શખ્સને મારાથી બચાવ.

(પ્રકરણ : ૫)

★ ફજરની નમાઝ પછીની દુઆઓ ★

અહીં ફક્ત ફજરની નમાઝ પછી પઢવાની દુઆઓનું વર્ણન કરવામાં આવે છે, નીચે દર્શાવેલ અમલો ફજરની નમાઝ પછી પઢવા.

★ અસંખ્ય ફાયદા ★

اللَّهُمَّ اكْفِنِي كُلَّ مَهْمٍ مِنْ حَيْثُ شِئْتَ
وَمِنْ أَيْنِ شِئْتَ حَسْبِيَ اللَّهُ لِيُدِيَنِي
حَسْبِيَ اللَّهُ لِيُدْنِي أَيَّ حَسْبِيَ اللَّهُ لِيَمَّا
أَهَمَّنِي حَسْبِيَ اللَّهُ لِيَمُنَّ بِي عَلَى حَسْبِيَ
اللَّهُ لِيَمُنَّ حَسَدِي حَسْبِيَ اللَّهُ لِيَمُنَّ
كَأَدِي بِي سَوْءٍ حَسْبِيَ اللَّهُ عِنْدَ الْمَوْتِ
حَسْبِيَ اللَّهُ عِنْدَ الْمَسْأَلَةِ فِي الْقَبْرِ
حَسْبِيَ اللَّهُ عِنْدَ الْمِيزَانِ حَسْبِيَ اللَّهُ
عِنْدَ الصِّرَاطِ حَسْبِيَ اللَّهُ الَّذِي لَا إِلَهَ

إِلَّا هُوَ عَلَيْهِ تَوَكَّلْتُ وَهُوَ رَبُّ الْعَرْشِ
الْعَظِيمِ

અલ્લાહુમ્મક ફિની કુલ્લ મુહિમ્મિમ્ મિન હેધુ શિયત્ વ મિન્ ઐન શિયત્ હસ્તિયલ્લાહુ લિ દીની હસ્તિયલ્લાહુ લિ દુન્યાય ★ હસ્તિયલ્લાહુ લિમા અહમ્મની હસ્તિયલ્લાહુ લિમન્ બગા અલય્યા હસ્તિયલ્લાહુ લિમન્ હસદની હસ્તિયલ્લાહુ લિમન્ કાદની બિ સૂઈન્ હસ્તિયલ્લાહુ ઈન્દલ્ મોતિ હસ્તિયલ્લાહુ ઈન્દલ્ મસ્અલતિ ફિલ્ કબ્રિ હસ્તિયલ્લાહુ ઈન્દલ્ મીઝાનિ હસ્તિયલ્લાહુ ઈન્દલ્ સિરાતિ હસ્તિયલ્લાહુલ્લગી લા ઈલાહ ઈલ્લાહુવ અલેહિ તવક્કલ્તુ વ હુવ રબ્બુલ્ અર્શિલ્ અઝીમ. (એક વખત પઢવું.)

ઉપરોક્ત દુઆ પઢનારની દરેક મુશ્કિલ આસન થશે, પરેશાની દૂર થશે, ઈમાન સલામત રહેશે, અલ્લાહ તઆલા દરેક જગ્યાએ તેની મદદ

ફર્માવશે, તેના દુશ્મન બર્બાદ થશે, ઈર્ષાણુ પોતાની ઈર્ષાની આગમાં સળગી જશે, તેની નજ્અ (સકરાત) આસાન થશે અને પુલસિરાત ઉપરથી આસાનીથી પસાર થશે.

ઉપરોક્ત વિદ્ ત્રણ વખત પઢવું વધુ અફઝલ છે.

★ હજજ અને ઉમરાનો સવાબ ★

ફજરની નમાઝ પછી તે જ સ્થિતિમાં બેઠા રહેવું, પગ પણ બદલવા નહીં અને તે જ સ્થિતિમાં બેઠા બેઠા ઝિક્રે ઈલાહીમાં મશ્ગૂલ રહેવું. ત્યાં સુધી કે સૂરજ ક્ષિતિજમાં ઊંચો થઈ જાય. એટલે કે તુલૂઅ આફતાબ (સૂર્યોદય) પછી લગભગ વીસ (૨૦) મિનિટ પસાર થઈ જાય, ત્યાર બાદ બે રકાત નફ્લ નમાઝ પઢવી, ઈન્શાઅલ્લાહ ! તેમ કરનારને પૂરા હજજ અને ઉમરાનો સવાબ મળશે.



(પ્રકરણ : ૬)

★ મગરિબની નમાઝ પછીના અમલો ★

અહીં મગરિબની નમાઝ પછીના અમલનું વર્ણન કરવામાં આવે છે

★ સલાતુલ્ અવ્વાબીન ★

મગરિબની ફર્જ પછી, છ (૬) રકાત એક જ સલામતથી પઢવી તેમાં દર બે (૨) રકાત પછી અત્તહિયાત, દુરૂદે ઈબ્રાહીમ અને દુઆએ માપૂરા પઢવી તથા ત્રીજી અને પાંચમી રકાતમાં ષના એટલે કે સુબ્હાનકલ્લાહુમ્મ.... (અંત સુધી) શરૂમાં પઢવી.

ઉપરોક્ત છ (૬) રકાતો પૈકીની પહેલી બે રકાતો સુન્નતે મોઅક્કેદા ગણાશે. આ નમાઝને "સલાતુલ્ અવ્વાબીન" કહેવામાં આવે છે અને અવ્વાબીન પઢનારાઓ માટે ખુદા મહેરબાન છે.



(પ્રકરણ : ૭)

★ રાતના સમયના અમલો ★

અહીં રાતના સમયના એટલે કે ગુરૂબ આફતાબ (સૂર્યાસ્ત)થી લઈને તુલૂએ ફજર (પરોઠ તથા પહેલાં) વચ્ચેના સમય દરમ્યાન પઢવાના અમલોનું વર્ણન કરવામાં આવે છે.

૧. સૂરએ મુલ્ક (તબારક), [(પા. -૨૯), (એક વખત પઢવું.)] જેની બરકતથી કબ્રની અઝાબથી નજાત મળશે.
૨. સૂરએ યા'સીન [(પા. ૨૨), (એક વખત પઢવું.)] જેની બરકતથી મગફિરત થશે.
૩. સૂરએ વાકિઆ [(પા. ૨૭) (એક વખત પઢવું.)] જેની બરકતથી ફાકાકશી, તંગદસ્તી નહીં થાય.
૪. સૂરએ દુખાન [(પા. ૨૫), (એક વખત પઢવું.)] જેની બરકતથી તેના માટે સિત્તેર હજાર (૭૦,૦૦૦) ફરિશ્તાઓ મગફિરતની દુઆ કરતા રહેશે.

(પ્રકરણ : ૮)

★ ઈશાની નમાઝ બાદ પઢવાની દુઆઓ ★

અહીં ઈશાની નમાઝ પછી પઢવાની દુઆઓનું વર્ણન કરવામાં આવ્યું છે :-

★ દીદારે નબી માટે ★

اللَّهُمَّ صَلِّ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ كَمَا مَرَرْنَا أَنْ
نُصَلِّيَ عَلَيْهِ ط اللَّهُمَّ صَلِّ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ
كَمَا هُوَ أَهْلُهُ ط اللَّهُمَّ صَلِّ عَلَى سَيِّدِنَا
مُحَمَّدٍ كَمَا نُحِبُّ وَتَرْضَى لَنَا ط اللَّهُمَّ صَلِّ
عَلَى جَسَدِ سَيِّدِنَا مُحَمَّدٍ فِي الْأَجْسَادِ ط
اللَّهُمَّ صَلِّ عَلَى قَبْرِ سَيِّدِنَا مُحَمَّدٍ فِي الْقُبُورِ
صَلَّى اللَّهُ عَلَى سَيِّدِنَا وَمَوْلَانَا مُحَمَّدٍ ط

અલ્લાહુમ્મ સલ્લિ અલા સચિયેદિના
મુહમ્મદિન્ કમા અમર્તાના અન્ તુસલ્લિલ્લી

અલૈદિ ★ અલ્લાહુમ્મ સલ્લિ અલા સચિયેદિના
મુહમ્મદિન્ કમા હુવ અહ્લુહુ ★ અલ્લાહુમ્મ
સલ્લિ અલા સચિયેદિના મુહમ્મદિન્ કમા તુહિબ્હુ
વ તદ્દા લહુ ★ અલ્લાહુમ્મ સલ્લિ અલા જસદિ
સચિયેદિના મુહમ્મદિન ફિલ્ અઝસાદ ★
અલ્લાહુમ્મ સલ્લિ અલા કબ્રિ સચિયેદિના
મુહમ્મદિન્ ફિલ્ કુબૂરી ★ સલ્લલ્લાહુ અલા
સચિયેદિના વ મૌલાના મુહમ્મદિન્.

એક વખતમાં જેટલી વાર બની શકે તેટલી વખત પઢવું.

ઝિયારતે અકદસ صلی اللہ تعالیٰ علیہ وسلم માટે ઉપરોક્ત વિદ્ સર્વોત્તમ વિદ્ છે. આ વિદ્ પઢનારને દીદારે નબીની ખુશી મળશે પરંતુ વિદ્ પઢનારે ફક્ત તા'ઝીમ નબીની નિયતથી પઢવું જોઈએ. આ વિદ્ પઢતી વખતે એવી નિયત ન રાખવી કે મને ઝિયારતે અકદસ صلی اللہ تعالیٰ علیہ وسلم નસીબ થાય એટલે જ પહું છું. બલકે આપનો કરમ અને આપની મહેરબાની બેહદ છે.

આ વિદ્ પઢતી વખતે મોહું મદીના તયુબાહની તરફ અને દિલને હુઝૂર અકદસ صلی اللہ تعالیٰ علیہ وسلم ની જનાબમાં હાજર રાખવું અને એવું ધ્યાન જમાવવું કે હું રોઝાએ અકદસ صلی اللہ تعالیٰ علیہ وسلم ની સામે હાઝિર છું અને એવું યકીન રાખે કે હુઝૂર અકદસ તાજદારે મદીના صلی اللہ تعالیٰ علیہ وسلم મને જોઈ રહ્યા છે. મારો અવાજ સાંભળી રહ્યા છે અને મારા દિલના વિચારોથી પણ જાણકાર છે.

★ આફતોથી બચવા ★

اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ اللَّهُ لَا إِلَهَ
إِلَّا هُوَ الرَّحْمَنُ الرَّحِيمُ ۚ اللَّهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ
سُبْحَانَكَ إِنِّي كُنْتُ مِنَ الظَّالِمِينَ ۖ صَلِّ وَسَلِّمْ
وَبَارِكْ أَبَدًا عَلَى النَّبِيِّ الْأَمِينِ وَآلِهِ وَ
أَصْحَابِهِ أَجْمَعِينَ ۚ اللَّهُ أَكْبَرُ ۚ اللَّهُ لَا إِلَهَ
إِلَّا اللَّهُ مُحَمَّدٌ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ تَعَالَى
عَلَيْهِ وَسَلَّمَ يَا عَوْثُ يَا عَوْثُ

અલ્લાહુ લા ઈલાહ ઈલ્લા હુવલ્ હય્યુલ્ કર્યૂમ ★ અલ્લાહુ લા ઈલાહ ઈલ્લા હુવરહમાનુરહીમ ★ અલ્લાહુ લા ઈલાહ ઈલ્લા અન્ત સુબ્હાનક ઈન્ની કુન્તુ મિનઝઝાલિમીન ★ સલ્લિ વ સલ્લિમ્ વ બારિક અબદન્ અલન્ નબિચ્ચિલ્ ઉમ્મિયિ વ આલિહી વ અરહાબિહી અજમર્દન ★ અલ્લાહુ અલ્લાહુ અલ્લાહુ લા ઈલાહ ઈલ્લલ્લાહુ મુહમ્મદુર્રસૂલુલ્લાહિ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વ સલ્લલમ યા ગૌષ ! યા ગૌષ ! (સો વખત પઢવું.)

ઉપરોક્ત વિદ્ પઢનારના ગુનાહોની મગફિરત થશે, દુનિયા અને આખિરતની આફતોથી છૂટકારો થશે અને તેનું દિલ સાફ રહેશે.

(પ્રકરણ : ૯)

★ રાત્રે સૂતી વખતે પઢવાના અમલો ★

અહીં રાત્રે સૂતી વખતે પઢવાની દુઆઓ અને વિદોનું વર્ણન કરવામાં આવે છે :-

46

★ જાદૂ, જિન અને ચોરથી બચવા ★

આયતુલ્ કુર્સી. (એક વખત પઢવું)

જેની બરકતથી તે શખ્સ જ્યાં સુધી સૂતો હશે ત્યાં સુધી અલ્લાહની હિફાઝતમાં રહેશે અને તેનું અને તેના પાડોશીઓનાં ઘર ચોરી, જાદૂ અને જિનથી સુરક્ષિત રહેશે.

★ જાગતાં જ ખુશી મેળવવા ★

તસ્બીહે હમ્દત સચ્ચદતિના ફાતિમતુર્રઝેહરા (رضي الله عنها). (જેનું વર્ણન પ્રકરણ : ૩ પેઈજ નં. ૩૧ માં આવી ગયું છે.) ઉપરોક્ત તસ્બીહ પઢનારને જાગતાની સાથે જ ખુશી પ્રાપ્ત થશે તે ઉપરાંત બીજા અસંખ્ય ફાયદા પણ થશે.

★ મુબારક વિદ્ ★

(૧) અલ્હમ્દુ શરીફ અને ચારેય કુલ શરીફ. (એક એક વખત પઢવું.)

46

(૨) સૂરએ બકરહના પહેલા રુકૂઅની : અલિફ-લામ-મિમથી મુફ્લિહૂન સુધીની આયતો છેલ્લા રુકૂઅની : આમનુર્રસૂલુથી કૌમિલ કાફિરીન્ સુધીની આયતો (એક એક વખત પઢવું.) ઉપરોક્ત વિદ્ ઘણો જ મુબારક વિદ્ છે અને તેના પઢનારને બેશુમાર ફાયદા મળશે.

★ ધાર્યા સમયે જાગવા માટે ★

(અંત સુધી.....) إِنَّ الْذَّيْنَ آمَنُوا

ઈન્નલ્ લમ્મીન આમનૂ વ અમિલુસ્સાલિહાતિ કાનત લહુમ જન્નાતુલ્ ફિરદૌસિ નુમુલા. ★ ખાલિદીન ફીહા લા યબ્ગૂન અન્હા હિવલા કુલ લવ કાનલ્ બહરુ મિદાદલ્ લિ કલિમાતિ રબ્બી લ નફિદલ્ બહરુ કબ્લા અન તન્ફદ કલિમાતુ રબ્બિ વ લવ જિઅ્ના બિ મિષ્લિહિ મદદા ★ કુલ ઈન્નમા અના બશરૂમ મિષ્લુકુમ યુહા ઈલચ્ચ અન્નમા ઈલાહુકુમ ઈલાહુવ વાહિદુન ફમન કાન ચરબૂ લિકાઅ રબ્બિહી

47

ફલ્ ચઅ્મલ અમલન્ સાલિહંવ વલા યુશ્રિક બિ ઈબાદતિ રબ્બિહિ અહ્દા. (એક વખત પઢવું.)

રાત્રે અથવા દિવસે સૂતી વખતે જે સમયે ઉઠવું હોય તે સમયે ઉઠવાની નિચ્ચતથી પઢીને સૂઈ જશે તો તે સમયે જ આંખ ઉઘડશે.

★ દરેક બલાથી મહેકૂમ રહેવા માટે ★

રાત્રે સૂતી વખતે બંને હાથની હથેળીઓ ઉપર ત્રણેય કુલ શરીફ પઢીને દમ કરવું, ત્યાર બાદ બંને હથેળીઓને માથા, ચહેરા, છાતી, આગળ, પાછળ જ્યાં સુધી હાથ પહોંચે ત્યાં ફેરવવી એમ કુલ ત્રણ વખત કરવું. ઈન્શાઅલ્લાહ ! દરેક બલાથી સલામત રહેશે.

★ ઈમાનની સાથે ખાતમા માટે ★

સૂરએ કાફિરુન એટલે કે :-

48

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
 قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ ○ لَا أَعْبُدُ مَا
 تَعْبُدُونَ ○ وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ ○
 وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدْتُمْ ○ وَلَا أَنْتُمْ عَابِدُونَ
 مَا أَعْبُدُ ○ لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ ○

સૌથી છેવટમાં પઢવી. ત્યાર બાદ કંઈ પણ બોલવું કે વાતચીત કરવી નહીં અને સૂઈ જવું. જો ઉપરોક્ત સૂરએ કાફિરુન પઢી લીધા બાદ વાત કરવાની જરૂરત પડે તો વાત કરી લીધા પછી ફરીથી તે સૂરત પઢી લેવી. ટૂંકમાં સૂની વખતે મોઢેથી સૂરએ કાફિરુનની આયતો જ અંતમાં પઢવાની ત્યાર બાદ કંઈ પણ બોલવું નહીં. જેની બરકતથી ઈન્શાઅલ્લાહ ! ખાત્મો ઈમાનની સાથે જશે.

★ જાગતાંની સાથે જ પઢવાની દુઆ ★

રાત્રે અથવા દિવસે ગમે ત્યારે ઊંઘમાંથી ઉઠે ત્યારે આંખ ઉઘડતાની સાથે જ નીચેની દુઆ પઢવી :-

الْحَمْدُ لِلَّهِ الَّذِي أَحْيَانَا بَعْدَ مَا أَلَمَاتْنَا
 وَاللَّيْلَةَ النَّسْوَةَ

અલ્ હમ્દુલિલ્લાહિલ્ લાઝી અહ્યાના બઅદ મા અમાતના વ ઈલેહિન્નુશૂર. (એક વખત પઢવું.)

ઉપરોક્ત દુઆની બરકતથી ઈન્શાઅલ્લાહ ! કયામતના દિવસે પણ અલ્લાહ તઆલાની હમ્દો પના કરતો ઉઠશે.

સૂચના : અહીં સુધી જેટલી દુઆઓ વર્ણન કરવામાં આવી છે તે દરેક દુઆ પઢતાં પહેલાં અવ્વલ આખિર દુરૂદ શરીફ પઢવું જરૂરી છે.

★ નમાઝે તહજુદ ★

ઈશાની નમાઝ પઢ્યા પછી થોડી વાર સૂઈ ગયા બાદ રાતમાં તુલૂએ ફજર પહેલાં ગમે ત્યારે આંખ ઉઘડે ત્યારે ઓછામાં ઓછી બે રકાત પઢવાથી તહજુદ અદા થઈ જશે. આઠ (૮) રકાત પઢવી સુન્નત છે અને મશાઈખે કિરામ બાર (૧૨) રકાતો

તહજુદ પઢતા હતા.

તહજુદમાં કિરાઅત પઢવા બાબત અધિકાર છે, જે સૂરત પઢવા યાહે તે પઢી શકે છે પણ બેહતર એ છે કે જેટલું પણ કુર્આન શરીફ યાદ હોય તેની તિલાવત તહજુદની રકાતોમાં કરે. જેને પૂરુ કુર્આન શરીફ યાદ હોય તો ઓછામાં ઓછી ત્રણ (૩) રાતોમાં અને વધુમાં વધુ ચાલીસ (૪૦) રાતોમાં કુર્આન શરીફ ખતમ કરે અને જો કુર્આન શરીફ મોઢે યાદ ન હોય તો દરેક રકાતમાં ત્રણ ત્રણ વખત સૂરએ ઈખ્લાસ (કુલ્ હુવલ્લાહુ અહદ) પઢે તો જેટલી રકાતો પઢશે તેટલી વખત કુર્આન શરીફ ખતમ કરવાનો સવાબ મળશે.

★ તસવ્વુરે શયખ ★

એકાંતમાં ઘોંઘાટથી દૂર થઈને શયખ (પીર)ના મકાન તરફ અને જો શયખનો ઈન્તેકાલ થઈ ગયો હોય તો જે તરફ શયખનો "મઝાર શરીફ" હોય તે તરફ ધ્યાન કેન્દ્રિત કરીને બેસવું. ફક્ત ખામોશ,

યુ પ-યા પ, અદબની સાથે શયખની સૂરત (ચહેરા)નું તસવ્વુર (ધ્યાન, ખ્યાલ) કરવું અને દિલમાં એવો ખ્યાલ (વિચાર) જમાવી રાખવો કે સરકારે દો આલમ عالم الدنيا وعالم الآخرة તરફથી ફયૂઝનો "નૂર" મારા શયખના દિલ ઉપર વરસાવી રહ્યો છે અને મારું દિલ મારા શયખના દિલની નીચે ભિખારીની હાલતમાં લાગેલું છે અને મારા શયખના હૃદયમાંથી ફયૂઝ અને નૂર ઉભરાઈ ઉભરાઈને મારા દિલમાં આવી રહ્યું છે.

ઉપરોક્ત તસવ્વુર (ધ્યાન)ને વધારવું ત્યાં સુધી કે તસવ્વુર બરાબર જામી જાય અને વારંવાર તસવ્વુર માટે કષ્ટ ન કરવું પડે, ત્યાં સુધી કે અંતરમાં શયખની સૂરત હમ-મિખલ થઈ મુરીદની સાથે રહેશે અને દરેક કામમાં મદદ કરશે અને તેના માર્ગમાં આવતી મુસીબતોનો ઉકેલ બતાવશે.

અગત્યની ભલામણ : વિદે વઝાઈફમાં મશ્ગૂલ થતાં પહેલાં જો નમાઝ અને રોઝાની કઝા

બાકી હોય તો તેને અદા કરી લેવા જરૂરી અને તેને વહેલામાં વહેલી તકે અદા કરવા જોઈએ, કેમ કે જેના ઉપર ફર્જ બાકી હોય તેને નફલ અને મુસ્તહબ અમલો ફાયદો આપતા નથી, બલકે જ્યાં સુધી બાકી છે ત્યાં સુધી તે કબૂલ થતા નથી.

વિશેષ ભલામણ : વિદોં માટે ત્રણ માર્ગદર્શક આવશ્યક છે : (૧) તકલીલે તઆમ (થોડું જમવું) (૨) તકલીલે કલામ (થોડું બોલવું) (૩) તકલીલે મનામ (થોડું ઊંઘવું.)

ખુદા નેક તૌફીક બખ્શનાર છે.

-અહમદ "રઝા" કાદરી
(૫ મી મહોર્રમ, સ.હિ. ૧૩૩૭)

નોંધ : અહીં આ'લા હઝરતની કિતાબ
"અલ્વઝીફતુલ્ કરીમહ" ખત્મ થઈ.



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

نَحْمَدُهُ وَنُصَلِّي عَلَى رَسُوْلِهِ الْكَرِیْمِ

મરનૂન દુઆઓ

દુઆ ઈબાદતનું મગ્ગ છે. (હદીષ શરીફ)

આજના મુસલમાનોએ હુઝૂર ﷺ ના તરીકા (સુન્નતો) છોડી દીધાં અને આપની બતાવેલ દુઆઓ છોડી દીધી જેથી તેમનામાં શૈતાનિયત આવી.

જે માણસ ઘરમાં પ્રવેશતી વખતે સલામ નહીં કરે તે ઘરમાં શૈતાન દાખલ થાય છે. પછી માણસ જમવા બેસે ત્યારે દુઆ નહીં પઢે તો શૈતાન તેના ખાવામાં શરીક થાય છે. માણસ જાજરમાં જવાની દુઆ નહીં પઢે તો શૈતાન પણ તેની સાથે જાજરમાં જાય છે, અને શર્મગાહ (જાજર, પેશાબની જગ્યા)થી શૈતાન રમે છે. પછી માણસ સૂતી વખતે

દુઆ નહીં પઢે તો શૈતાન તેની સાથે સૂઈ જાય છે અને માણસ પોતાની બીબી સાથે હમબિસ્તરી કરતી વખતે જો દુઆ નહીં પઢે તો શૈતાન પણ તેની બીબી સાથે હમબિસ્તરી કરે છે.

માટે મુસલમાનોએ જરૂરી દુઆઓ યાદ કરી તેના વખત પર અદા કરવી એ જ ઝિક્કુલ્લાહ છે. ફર્જી ઈબાદતની પાબંદી સાથે હદીષની દુઆઓ અને બુઝુર્ગાને દીનના બતાવેલા અમલિયાત પઢવાથી દીન અને દુનીયાની બેશુમાર નેઅમતો અને બરકતો હાંસલ થાય છે.

દુઆઓની આગળ પાછળ દુરૂદ શરીફ પઢવું જરૂરી છે. અલ્લાહ તઆલા દરેક સુન્ની સહીહુલ્ અકીદા મુસલમાનને નેક અમલ કરવાની તૌફીક અતા ફર્માવે. (આમીન)

ગદ્દએ નૂસી વ રઝા
મુહમ્મદ અનીસ નૂરી રઝવી
(પ્રમુખ : નૂરી એકેડમી, સૂરત)

★ રાત્રે સૂતી વખતની દુઆ ★

اللّٰهُمَّ بِاسْمِكَ أَمُوتُ وَأَحْيَى -

અલ્લાહુમ્મ બિ ઈસ્મિક અમૂતુ વ અહ્યા.

★ રાત્રે ઊંઘમાંથી જાગે ત્યારે પઢવાની દુઆ ★

લા ઈલાહ ઈલ્લલ્લાહુ વહ્દહુ લા શરીક લહુ લહુલ્ મુલ્કુ વલ્હુલ હમ્દુ વ હુવ અલા કુલ્લિ શયઈન કદીરિવ્ વ સુબ્હાનલ્લાહિ વલ્ હમ્દુલિલ્લાહિ વલા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર વલા હવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ.

★ સ્વપ્નમાં ડરી જાવ ત્યારે પઢવાની દુઆ ★

અભીમુ બિ કલિમતિલ્લાહિતામાતિ મિન્ગદ બિહી વ ઈકાબિહી વશારિ ઇબાદિહી વ મિન હમઝાતિશશયાતીનિ અંચ ચહ્દુરૂન. (આ દુઆ

અલ્લાહુમ્મ અર્થમ્ મન્ અત્અમની વસ્કિ
મન્ સફાની.

★ દૂધ પીધા પછી પઢવાની દુઆ ★

اَللّٰهُمَّ بَارِكْ لَنَا فِيْهِ وَزِدْنَا مِنْهُ .

અલ્લાહુમ્મ બારિક લના ફીહિ વઝિદના મિનહુ.

★ નવાં કપડાં પહેરતી વખતે
પઢવાની દુઆ ★

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِيْ كَسَانِيْ مَا وَاَرَىْ بِهِ عَوْرَتِيْ وَاتَجَمَّلُ
بِهِ فِيْ حَيَاتِيْ ۝

અલ્હમ્દુલિલ્લાહિલ્લાહી કસાની માઉવારી
બિહી ઓરતી વ અતજમલુ બિહી ફી હયાતી.

★ મુસીબતમાં અથવા મૃત્યુ
વખતે પઢો ★

اِنَّا لِلّٰهِ وَاِنَّا اِلَيْهِ رَاٰجِعُوْنَ ، اَللّٰهُمَّ اَجِرْنِيْ فِيْ
مُصِيْبَتِيْ وَاخْلِفْ لِيْ خَيْرًا مِنْهَا

61

ઈન્ના લિલ્લાહિ વ ઈન્ના ઈલૈહિ રાજિબિન
અલ્લાહુમ્મ અજિર્ની ફી મુસીબતી હાઝા
વખ્લિફલી ખૈરમ્ મિન્હા.

★ દુહા દુહનને મુબારકબાદીની
દુઆ ★

بَارِكْ اَللّٰهُ لَكَ وَبَارِكْ عَلَيْكَ وَجَمِّمْ بَيْنَنَا فِيْ خَيْرٍ

બારકલ્લાહુ લક વ બારક અલૈક વજમમ
બૈનકુમા ફી ખયરિન્.

★ પહેલી રાત્રે દુહો દુહનને
જુએ તો પેશાનીના વાળ પકડી
આ દુઆ પઢે ★

اَللّٰهُمَّ اِنِّيْ اَسْئَلُكَ مِنْ خَيْرِهَا وَخَيْرِ مَا جَبَلْتَهَا عَلَيَّ
وَاعُوْذُ بِكَ مِنْ شَرِّهَا وَشَرِّ مَا جَبَلْتَهَا عَلَيَّ

અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલુક મિન ખયરિહા
વ ખયર મા જબલ્તહા અલૈહિ વ અઊઝુ

62

બિક મિન શરિહા વ શરિ મા જબલ્તહા
અલૈહિ.

★ જ્યારે પોતાની પત્નીથી
સોહબત કરવાનો ઈરાદો કરે તો
આ દુઆ પઢે ★

بِسْمِ اللّٰهِ اَللّٰهُمَّ جَبِّبْنَا الشَّيْطَانَ وَجَبِّبِ الشَّيْطَانَ
مَا رَزَقْتَنَا .

બિસ્મિલ્લાહિ અલ્લાહુમ્મ જબ્બિબ નશ
શૈતાન વ જબ્બિ બિશ્શૈતાન મા રઝકતના.

★ ઈન્આલ થાય ત્યારે
પઢવાની દુઆ ★
(દિલમાં પઢવાની દુઆ)

اَللّٰهُمَّ لَا تَجْعَلْ لِلشَّيْطَانِ فِيْ مَا رَزَقْتَنِيْ نَصِيْبًا ۝

અલ્લાહુમ્મ લા તજઅલ્ લિશ્શયતાનિ ફીમા
રઝકતની નસીબા.

63

★ ગુસ્લે જનાબતની નિરયત ★

નયૈલુ અન અગ્તસિલા મિન ગુસ્લિલ્
જનાબતિ લિરફઇલ્ હદ્ધી.

★ મુસલમાન ભાઈને હસતો જુએ
તો પઢે ★

اَضْحَكَ اَللّٰهُ سِنَّكَ .

★ આઈનામાં મોઢું જુઓ ત્યારે ★

અલ્હમ્દુલિલ્લાહિ અલ્લાહુમ્મ કમા હસ્સનત
ખલ્કી ફ હસ્સિન ખુલ્કી.

★ જ્યારે કોઈ એહસાન કરે
ત્યારે કહો ★

اَللّٰهُمَّ اَجِرْ جَزَاكَ اَللّٰهُ خَيْرًا

★ ઈંક આવે ત્યારે પઢવાની દુઆ ★

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ

64

અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ્ આલમીન.

સાંભળનાર જવાબમાં : يَرْحَمُكَ اللهُ
ચર્હમુક્કલાહ કહે એ પછી છીંકનાર ફરીથી
يَغْفِرُ اللهُ لِيْ وَكَفَّرَ
યગ્ફિરુલ્લાહુ લી વલકુમ્ કહે.
(છીંકનો જવાબ આપવો વાજિબ છે.)

★ ઘરમાંથી બહાર જતી વખતે ★

بِسْمِ اللهِ تَوَكَّلْتُ عَلَى اللهِ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللّٰهِ

બિસ્મિલ્લાહિ તવક્કલ્તુ અલ્લાહિ લા હવ્લ
વલા કુવ્વત ઈલ્લાબિલ્લાહ.

★ ઘરમાં દાખલ થતી વખતે

પઢવાની દુઆ ★

اللّٰهُمَّ اِنِّيْ اَسْئَلُكَ خَيْرَ الْمَوْلِجِ وَخَيْرَ الْمَخْرَجِ. بِسْمِ اللّٰهِ
وَلَجْنَا وَبِسْمِ اللّٰهِ خَرَجْنَا وَعَلَى اللّٰهِ رَبِّنَا تَوَكَّلْنَا.

અલ્લાહુમ ઈન્ની અસ્અલુક ખૈરલ્ મવ્લજિ
વ ખૈરલ્ મખરજિ. બિસ્મિલ્લાહિ વલજના

66

વબિસ્મિલ્લાહિ ખરજના વ અલ્લાહિ રબ્બના
તવક્કલના.

★ બજારમાં જતી વખતની દુઆ ★

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ
الْحَمْدُ يُحْيِي وَيُمِيتُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ ۝

લા ઈલાહ ઈલ્લાહુ વહ્દહુ લાશરીક
લહુ લહુલ્ મુલ્કુ વલહુલ હમ્દુ યુહી વયુમિતુ
વ હુવ હૈયુલ્ લાયમૂતુ બિયદિહિલ્ ખૈર, વહુવ
અલા કુલ્લિ શય્ઈન્ કદીર.

ફઝીલત : જે શખ્સ બજારમાં પગ મૂકતી વખતે
ઉપરોક્ત દુઆ પઢશે તેના માટે અલ્લાહ તઆલા
દસ લાખ નેકીઓ લખી દેશે, દસ લાખ ખતાઓ
માફ કર્માવશે અને તેના દસ લાખ દરજ્જાઓ બુલંદ
કર્માવશે અને તેના માટે જન્નતમાં એક મહેલ
બનાવી દેશે.

66

★ બજારમાં કંઈક વેચવું અથવા

ખરીદવું હોય તો આ દુઆ

પઢવી ★

(બજારની ખુરાઈઓથી રક્ષણ મેળવવા)

બિસ્મિલ્લાહિ અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલુક
ખયર હાઝિહિસ્સૂકિ વ ખયર મા ફિહા વ
અઊમુબિક મિન્ શરિહા વશરિ મા ફીહા
અલ્લાહુમ્મ ઈન્ની અઊમુ બિક મિન્ અન્
ઉસિબ ફીહા યમિનન્ ફાજિરતન્ અવ સફકતન્
ખાસિરતન્.

(બજારથી પાછા ફરે ત્યારે કુર્આન શરીફની
કોઈપણ દસ આયત પઢવી.)

★ માલ દૌલતમાં બરકત માટે ★

અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદિન્ અબ્દિક
વ રસૂલિક વ અલલ્ મુઅમિનીન વલ્ મુઅમિનાતિ
વ અલલ્ મુસ્લિમીન વલ્ મુસ્લિમાત.

67

★ જો માલ ન વેચાતો હોય તો

પઢવાની દુઆ ★

જેનો માલ ન વેચાતો હોય તેણે દરરોજ સવાર
સાંજ સૂરએ અલમ નશરહ ઉ વાર પઢી માલ
પર દમ કરતા રહેવું.

★ બીમારને જોઈને પઢવાની દુઆ ★

(જે બીમારને જોઈને આ દુઆ પઢશે તો તે
બીમારીથી પઢનાર સુરક્ષિત રહેશે.)

الْحَمْدُ لِلّٰهِ الَّذِيْ عَافَانِيْ مِمَّا بَلَآكَ بِهِ
وَفَضَّلَنِيْ عَلَى كَثِيْرٍ مِّمَّنْ خَلَقَ تَفَضُّلًا

અલ્હમ્દુ લિલ્લાહિલ્લાઝી આફાની મિમ્
મબ્તલાક બિહિ વફ્દલ્ની અલા કસીરીમ્ મિમ્મન
ખલક તફ્દીલા.

નીચેની બીમારીમાં ઉપરોક્ત દુઆ પઢવાની
નથી :-

(૧) જુકામ (૨) આંખ દુઃખવી (૩) ખુજલી.

68

★ બુખાર (તાવ)ની દુઆ ★

بِسْمِ اللَّهِ الْكَبِيرِ وَأَعُوذُ بِاللَّهِ مِنْ شَرِّكَ
عَرَقِي تَعَارُؤُ مِنْ شَرِّ حَرِّ النَّارِ.

બિસ્મિલ્લાહિલ્ કબીરિ વ અઊઊ બિલ્લાહિલ્ અઝીમિ મિન્ શરિ કુલ્લિ અર્કિન્ નઆરિવ્ વમિન્ શરિ હરિન્નાર.

★ બદ્ નઝરની દુઆ ★

બિસ્મિલ્લાહિ અલ્લાહુમ્મ ઝ હરહા વ બરદહા વસબહા.

★ કોઈપણ બીમારીમાં પટવાની દુઆ ★

રબુનલા હુલ્લાઝી તકદુસ ઈસ્મુક અમરુક ફિસ્સમાઈ વલઅઈ કમા રહમલુક ફિસ્સમાઈ ફજઅલ રહમતક ફિલ્ અઈ વગ્ફિર લના મુનુબના વ અન્ત રબુત તચિબીન અન્નિલ

રહમતમ મિન રહમતિક્વ વ શિફાઅમ્ મિન્ શિફાઈક અલા હાઝલ્ વજઈ.

★ સૂરમો નાખતી વખતની દુઆ ★

اللَّهُمَّ مَتَّعْنِي بِالسَّمْعِ وَالْبَصَرِ.

અલ્લાહુમ્મ મતિઅની બિસ્સમઈ વલ્ બસર.

★ નવો ચાંદ જોઈને પટવાની દુઆ ★

(પહેલાં અલ્લાહુ અકબર કહે પછી પઢે :)

اللَّهُمَّ أَهْلَهُ عَلَيْنَا بِالْإِيمَانِ وَالسَّلَامَةِ وَالْإِسْلَامِ
وَالتَّوْفِيقِ لِمَا تُحِبُّ وَتَرْضَى رَبِّي وَرَبُّكَ اللَّهُ.

અલ્લાહુમ્મ અહિલ્લાહુ અલેના બિલ્યુમ્બિ વલ્ ઈમાની વસ્સલામતિ વલ્ ઈસ્લામિ વતૌફીકિ લિમા તુહિબ્બુ વતદા રબી વ રબુકલ્લાહુ. અને પછી નીચેની દુઆ પઢે (ત્રણ વખત) અલ્લાહુમ્મર્જુકના ખચરહૂ વનસ્રહૂ બરકતહૂ વફ્હહૂ વનૂરહૂ વનઊઊ બિક મિન શરિહી

વશરિ મઅ્ બઅદહુ.

★ મરઘાનો અવાજ સાંભળે

ત્યારે પટવાની દુઆ ★

(મરઘો ફરિશ્તાને જોઈને બોલે છે.)

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ.

અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલુક મિન્ફલ્લિક.

★ ગઘેડાનો અથવા કૂતરાનો અવાજ સાંભળે ત્યારે પટવાની દુઆ ★

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ

અઊઊ બિલ્લાહિ મિનશશય્તાનિર્જીમ.

નોંધ : જ્યારે ગુસ્સા આવે ત્યારે પણ ઉપરોક્ત દુઆ પઢવી.

★ દુશ્મનનો ભય હોય ત્યારે આ દુઆ પઢો ★

અલ્લાહુમ્મ ઈન્ના નજઅલુક ફી નૂહરિહીમ

વ નઊઊ બિક મિન્ શુરિહીમ.

★ મુસાફરીની દુઆ ★

ટ્રેન, વાહન વગેરેની મુસાફરીમાં પ્રથમ બિસ્મિલ્લાહિર્હમાનિર્હીમ પઢવું પછી દુરૂદ શરીફ, ૩ વખત અલ્લાહુ અકબર ૩ વખત અલ્હમ્દુ લિલ્લાહ, ૩ વખત સુબહાનલ્લાહ, ૩ વખત પછી લા ઈલાહ ઈલ્લલ્લાહ અને ૧ વખત પછી દુઆ પઢો :-

الْحَمْدُ لِلَّهِ سُبْحَانَ الَّذِي سَخَّرَ لَنَا هَذَا وَمَا كُنَّا
مُقْرِنِينَ وَإِنَّا إِلَى رَبِّنَا لَمُنْقَلِبُونَ.

સુબહાનલ્લાઝી સખ્ખર લના હાઝા વમા કુન્ના લહુ મુકરિનીન્ વ ઈન્ના ઈલા રબિબના લ મુન્કલિબૂન. (એક વખત પઢવું.)

ઈલાહી ખૈર ગરદાની બ હકિક શાહે જુલાની (ત્રણ વખત) પછી દુરૂદ શરીફ ૩ વખત પઢવું.

★ જ્યારે કબરતાનમાં જાવ ત્યારે
પઢવાની દુઆ ★

અસ્સલામુ અલૈકુમ વ રહ્મતુલ્લાહિ વ
બરકાતુહુ યા અહલલ્ કુબૂરિ યગ્ફિરુલ્લાહુ
લના વલકુમ્ અન્વુમ્ સલફના વ નહુનુ બિલ્
અસ્સ ઈન્શાઅલ્લાહુ બિકુમ્ લાહિકૂન્.

★ અઝાન પઢીની દુઆ ★

اللَّهُمَّ رَبِّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ
الْقَائِمَةِ ابْتَسِدْنَا مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ
وَالدَّرَجَةَ الرَّفِيعَةَ وَأَبْعَثْهُ مَقَامًا مَحْمُودًا
إِلَى الذِّمَى وَعَدَّتْهُ وَأَرْضًا قُنَا شَفَاعَتَهُ يَوْمَ
الْقِيَامَةِ إِنَّكَ لَا تَخْلِفُ الْمِيعَادَ

અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિ દઅવતિતામ્મતિ
વસ્સલાતિલ્ ફાઈમતિ આતિ સચ્ચિદિના વ

મોલાના મુહમ્મદનિલ્ વસીલત વલ્ ફદીલત
વદરજતરફીઅત વબઅહુ મકામમ્ મહમૂદનિલ્લાહી
વ અતહુ વર્ઝુકના શફાઅતહુ યવમલ્ કિયામતિ
ઈન્નક લા વુખ્લિકુલ્ મીઆદ.

★ જ્યારે કોઈ વાત મરજી પ્રમાણે
બની જાય ત્યારે પઢવાની દુઆ ★

અલ્હમ્દુલિલ્લાહિલ્ અઝીમિ બિ નિઅમતિહી
તતીમ્મુસ્ સાલિહાત.

★ જ્યારે કોઈ વાત મરજી વિરૂદ્ધ
બની જાય ત્યારે પઢવાની દુઆ ★

અલ્હમ્દુ લિલ્લાહિ અલા કુલ્લિ હાલ.
હુઝૂર صلی اللہ تعالیٰ علیہ وسلم ફર્માવે છે કોઈ મારા પર હુરૂદ્
શરીફ પઢયા પછી નીચેના કલેમાત પઢશે તેના પર
મારી શફાઅત વાજિબ થઈ જશે.

અલ્લાહુમ્મ અઝીલહુલ્ મકઅદલ્ મુકર્રબ
ઈન્નક યવ્મલ્ કિયામતિ.

★ શૈતાની વસવસાથી બચવાની
દુઆ ★

રબ્બિ અબીમુ બિક મિન્ હમઝાતિશ્શયાતિનિ
વ અબીમુ બિક રબ્બિ અંયહદુરુન.

કેટલાક વિદો-વઝાઈફ

★ યા ગનીમુ ★

જો હુકાનદાર અથવા વેપારી હુકાન કે વેપારના
મકાનનું તાળુ ખોલતાં પહેલાં ૭૦ વખત ઉપરોક્ત
નામને પઢશે તો ઈ-શાઅલ્લાહ ! વેપારના માલમાં
બરકત થશે.

★ યા નાફિમુ ★

દરેક નવી વસ્તુ કે માલની ખરીદી પહેલાં ૪૧
વાર ઉપરોક્ત નામ પઢો ઈ-શાઅલ્લાહ ! વેપારમાં
ઘણી બરકત જોવા મળશે.

★ ચિંતા, રંજ અને ગમથી
સુરક્ષિત રહેવા માટેનો અમલ ★

હઝરત સમુરહ ઈબને ઝુન્દુબ رضي الله عنه થી
રિવાયત છે કે રસૂલે ખુદા صلی اللہ تعالیٰ علیہ وسلم એ ફર્માવ્યું :
અફઝલુલ કલામિ અર્બબિન : સુબ્હાનલ્લાહિ
વલહમ્દુલિલ્લાહિ વલા ઈલાહ ઈલ્લાહુ વલ્લાહુ
અકબર. (દરરોજ ૧૦૦ વખત પઢવું.)

(અર્થ : સર્વોત્તમ કલામ ચાર છે.)

(૧) સુબ્હાનલ્લાહ (૨) અલ્હમ્દુલિલ્લાહ (૩)
લા ઈલાહ ઈલ્લાહ (૪) અલ્લાહુ અકબર.

★ રોજીની પરેશાની દૂર

કરવાનો અમલ ★

એક સહાબીએ હુઝૂર રહ્મતુલ્ લિલ્ આલમીન
صلی اللہ تعالیٰ علیہ وسلم ની બિદમતમાં હાજર થઈ અર્ઝ કરી,
દુનિયાએ મારાથી પીઠ ફેરવી લીધી છે. હુઝૂર
صلی اللہ تعالیٰ علیہ وسلم એ ફર્માવ્યું તમને ફરિશ્તાઓની તસ્બીહ

યાદ નથી કે જેની બરકતથી રોજી આપવામાં આવે છે. ખુદાની મખ્લૂક (દૌલત) તમારી પાસે ઝલીલ અને ખ્વાર થઈને આવશે.

સુબહાનલ્લાહિ વબિ હમ્દિહી સુબહાનલ્લાહિલ અઝીમિ વબિ હમ્દિહી અસ્તગફિરુલ્લાહ. (સુબ્હ સાદિક વખતે ૧૦૦ વખત પઢે) ન બને તો સૂર્યોદય પહેલાં પઢી લે.

★ રોજીમાં બરકત અને કલના અઝાબથી સુરક્ષિત રહેવાનો અમલ ★

જે માણસ નીચેનો વિદ્ રોજ ૧૦૦ વાર પઢશે તેની રોજી બહોળી થશે, કબ્રના અઝાબથી બચશે, મરતી વેળા રૂહને જન્નતમાં જવા માટે સર્વે દરવાજા ખૂલી જશે. આ કલમો રોજીએ અન્વર صلی اللہ تعالیٰ علیہ وسلم ની જાલી મુબારક પર લખવામાં આવ્યો છે :-

લાઈલાહ ઈલ્લાહુલ્ મલિકુલ્ હક્કુલ્ મુબીનુ મુહમ્મદુર્સૂલુલ્લાહિ સાદિકુલ્ વખ્દુલ્ અમીનુ.

★ આફત બલાથી બચવાની દુઆઓ ★

બિસ્મિલ્લાહિર્હમાનિર્હીમ અલ્લાહુ હફીમુન્ લતીફુન્ કદીમુન્ અઝલીયુન્ હય્યુલ્ કય્યુમ્ લાયનામ.

ફાયદા : જે શખ્સ સફરમાં ઉપરોક્ત વિદ્ને સાત વખત પઢી લેશે તે હર બલા તેમજ આફતથી મેહફૂઝ રહેશે. આ દુઆને લખીને ઘરમાં અથવા પેટીમાં રાખવાથી ચોરીનો ડર રહેશે નહીં.

ઉપરોક્ત વિદ્ને સવાર સાંજ ૧૧ વખત પઢવાથી અમનો અમાનમાં રહેશે. તમામ ગમ, પરેશાનીઓ દૂર થશે અને માલમાં બહોળી બરકત થશે.

હસ્બિચ્ચલ્લાહુ લા ઈલાહ ઈલ્લા હૂ અલૈહિ તવક્ક્લુ વહુવ રબુલ્ અર્શિલ્ અઝીમ.

ફાયદા : ઉપરોક્ત વિદ્ સવાર સાંજ ૧૦ વખત પઢવાથી દુનિયા તેમજ આખેરતના તમામ

ગમ, બલા, આફત, મુસીબતથી મેહફૂઝ રહેશે. તેમજ ઊંચી જગ્યાએથી પડી જવાથી અને આગમાં બળી જવાથી સુરક્ષિત રહેશે. આ સિવાય બીજા અસંખ્ય ફાયદાઓ પણ છે.

★ અલ્લાહ તઆલાની નજીક સૌથી પ્યારી વાત નીચેની દુઆ છે તે પઢો ★

સુબહાનલ્લાહિ લા શરીક લહુલ્ મુલ્કુ વલ્હુલ્ હમ્દુ વ હુવ અલા ફુલ્લિ શય્ઈન્ કદીર વલા હવ્લ વલા ફુવ્વત ઈલ્લા બિલ્લાહિ સુબહાનલ્લાહિ વબિ હમ્દિહી. (દરરોજ એક વાર પઢો.)

★ સરકાર صلی اللہ تعالیٰ علیہ وسلم ના માટે દુઆ ★

જઝલ્લાહુ અન્ન સૈયદના મુહમ્મદન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમા બિમા હુવ અહ્લુહૂ. [જે આ દુઆને ૧ વાર પઢશે તેના માટે ૭૦ ફરિશ્તા

એક હજાર વરસ સુધી નેકીઓ લખતા રહેશે. (દરેક નમાઝ પછી પઢો.)]

★ દિવસમાં ફક્ત એક વાર ★

લા ઈલાહ ઈલ્લાહુ વહ્દહૂ લા શરીક લહુ અહદન્ સમદન લમ્ ચલીદ વલમ્ ચુલદ વલમ્ ચકુલ્લહુ ફુફુવન્ અહદ.

આ દુઆ એક વાર દરરોજ પઢવાથી અલ્લાહ તઆલા ૨૦ લાખ નેકીઓ અતા ફર્માવે છે. (હદીથ શરીફ)

★ દિવસમાં ૨૭ વખત ★

રબ્બિગ્ ફિલી વલિ વાલિદચ્ચ વલિલ્ મુ'મિનીન વલિલ્ મુ'મિનાતિ ચવ્મ ચકુમુલ્ હિસાબ.

આ દુઆ દિવસમાં ૨૭ વખત પઢવાથી અલ્લાહ તઆલા હઝરત આદમ عليه السلام થી લઈને કયામત સુધીના મુસલમાનોની ગણતરીના બરાબર નેકીઓ અતા ફર્માવશે.

★ શહાદતને મેળવવાની દુઆ ★

अल्लाहुम्म બારિક લી ફિલ્ મૌતિ વફી મા બઅદલ મૌતિ સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ.

ફઝીલત : જે માણસ દિવસમાં ૨૫ વાર મૌતને યાદ કરશે અલ્લાહ તઆલાના હુકમથી તેને શહાદતનો દરજ્જો મળશે, તે માટે આ દુઆ ૨૫ વાર પઢવી. એક તસ્બીહ પઢવાથી અલ્લાહ પાક એક લાખ ચોવીસ હજાર નેકીઓ અતા ફર્માવે છે.

★ મર્મલ મૌતની દુઆ ★

(જે બીમારીથી મૌત આવે તેવી બીમારીમાં પઢવાની દુઆ)

લા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર વલા હવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહિલ્ અલીય્યિલ્ અઝીમ.

આ દુઆ દરેક બીમારી વખતે ૪૦ વખત પઢવી

શું ખબર કે તે જ બીમારીમાં મૌત થાય. જે પઢશે તેને શહાદતનો સવાબ મળશે.

★ ફજરની તથા મગરિબની નમાઝ પછી પઢવાની દુઆ ★

સુબ્હાનલ્લાહિ વબિહમ્દિહી અદદ ખલ્કિહી વ રિદા નફ્સિહી વઝીનતિ અર્શિહી વ મિદાદ કલિમાતિહિ. (ત્રણ-ત્રણ વખત)

ફઝીલત : ફજરની નમાઝ પઢયા પછી ચાશતના સમય સુધી મુસલ્લા પર બેસીને તસ્બીહ પઢનાર (વિદો-વઝાઈફમાં મશ્ગૂલ રહેનાર) કરતાં વધારે સવાબ મળે છે.

★ માશાઅલ્લાહ ! ★

ઉપરના નામને ઈશાની નમાઝ પછી દિલની ખુલૂસ અકીદત મહબ્બતથી ૩૦૦ વખત પઢવાથી ખુદાપાક હજજે બયતુલ્લાહની ઝિયારત નસીબ કરે છે અને તમન્ના પૂરી થાય છે.

★ યા અર્હમર્રહિમીન ★

દરેક સંકટ, મુસીબત અને તમામ આફતોમાં ઉપરના નામ મુબારકનો વિદ્ અકસીર ઈલાજ છે. ઈશાની નમાઝ પછી સજદામાં ૧૦૦ વાર આ નામને પઢવું. અસાધ્ય રોગ અને ભારેમાં ભારે મુસીબતથી નજાત મેળવવાનું સાધન છે.

★ યા વાજિદુ ★

જે માણસ ખાતી વખતે દરેક કોળીયા ઉપર એ નામ મુબારકને પઢતો રહેશે તો તે ખોરાક તેના પેટમાં નૂર બની જશે. એમ કરવાથી નમાઝમાં વહેમ વસવસા દૂર થશે.

★ ખાતમા બિલ્ ખૈરની દુઆ ★

ફાતિરસ્સમાવાતિ વલ્અઈ અન્ત વલીય્યિ ફિદુન્યા વલ્આબિરતિ તવફ્ફની મુસ્લિમંવ વઅલ્હિકની બિસ્સાલિહીન. (હમેશાં દરેક નમાઝ પછી જરૂર પઢો)

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

મુબારક રાત તથા દિવસોની ઈબાદતો

❖ યૌમે આશૂરાની ઈબાદતો ❖

ઈસ્લામનો દરેક મશહૂર અને મુબારક દિવસ રોજ કરતાં અધિક ઈબાદત કરીને જ પસાર કરવાની ઈસ્લામ તા'લીમ આપે છે. મુસલમાનો! ગંભીરતાથી ધ્યાન કરો. વર્તમાનકાળમાં ચાલતી તાઝીયાદારી જે શીઆઓની દેખાદેખી જાહિલ સુન્નીઓમાં પણ ચાલી રહી છે. તાઝીયાદારીની આ સર્વ ધાંધલ ધમાલ, જુલૂસબાઝી સર્વ સદંતર હરામ છે, એનાથી દૂર રહેવું. તમારે ગૈર કૌમોની જેમ નાય ફૂદ કે મનોરંજન ધાંધલ ધમાલમાં અટવાવાનું નથી. સાંભળો :-

જે કોઈ મોહર્રમના પ્રથમ જુમ્આનો રોઝો રાખે તો તેના પાછલા ગુનાહો માફ થઈ જાય છે. (રાવી :

હઝરત અનસ (رضي الله عنه)

જે કોઈ મોહરમના ત્રણ રોજા રાખે તો તેના માટે ૯૦૦ વરસની ઈબાદતનો સવાબ લખવામાં આવે છે.

★ આશૂરાની રાતના નવાફિલ ★

ચાર રકાત નફલ નમાઝ : દરેક રકાતમાં "અલ્હમ્દુ શરીફ" પછી "કુલ્હુવલ્લાહ શરીફ" પચાસ વખત પઢે.

ફઝીલત : પઢનારાના પચાસ વર્ષ આગળના અને પચાસ વર્ષ પાછળના ગુનાહ (સગીરા) બખ્શી દેવામાં આવે છે.

ચાર રકાત નફલ નમાઝ : દરેક રકાતમાં "અલ્હમ્દુ શરીફ" પછી "આયતુલ કુર્સી" એક વખત અને "કુલ્હુવલ્લાહ શરીફ" ત્રણ વખત પઢે. નમાઝ પઢી લીધા બાદ ૧૦૦ વખત "કુલ્હુવલ્લાહ શરીફ" પઢે પછી દુઆ માંગે.

86

ફઝીલત : આ પઢનાર ગુનાહોથી પાક થઈ જશે અને તેને જન્મતમાં અગણિત નેઅમતો પ્રાપ્ત થશે.

બે રકાત નફલ નમાઝ : "અલ્હમ્દુ શરીફ" પછી "કુલ્હુવલ્લાહ શરીફ" ત્રણ વખત પઢે.

ફઝીલત : હક્ક તઆલા તેની મહેરબાનીથી કયામત સુધી આ પઢનારની કબ્રને રોશન અને મુનવ્વર રાખશે.

હદીષે પાકમાં આશૂરાના રોજાથી ઘણી ફઝીલત આવી છે. રમઝાન શરીફ પછી બેહતર રોજા મુહરમના આશૂરાના રોજા છે. ૯, ૧૦, અથવા ૧૦, ૧૧ એમ બે દિવસે રોજા રાખી યહૂદીઓની મુખાલેફત કરો.

★ આશૂરાના દિવસના નવાફિલ ★

૪ રકાત નફલ : દરેક રકાતમાં "અલ્હમ્દુ શરીફ" પછી પાંચ વખત "કુલ્હુવલ્લાહ શરીફ" પઢે. અને તેનો સવાબ સરકારે દો આલમ صلوات الله تعالى عليه

88

ની રૂહે મુબારકને પહોંચાડે.

૪ રકાત નફલ : દરેક રકાતમાં "અલ્હમ્દુ શરીફ" પછી ત્રણ-ત્રણ વખત "કુલ્હુવલ્લાહ શરીફ" પઢે. અને તેનો સવાબ હઝરત ફાતિમાતુઝ્ઝોહરાની રૂહે મુબારકને પહોંચાડે.

૪ રકાત નફલ : દરેક રકાતમાં "અલ્હમ્દુ શરીફ" પછી પાંચ પાંચ વખત "કુલ્હુવલ્લાહ શરીફ" પઢે. અને તેનો સવાબ હઝરત ઈમામ હસન અને ઈમામ હુસૈનની રૂહે મુબારકને પહોંચાડે.

૬ રકાત નફલ : દરેક રકાતમાં "અલ્હમ્દુ શરીફ" પછી જે સૂરત યાદ હોય તે કમશ: (તરતીબથી) પઢે અથવા ત્રણ-ત્રણ વખત "કુલ્હુવલ્લાહ શરીફ" પઢે. આ છ રકાત પૂરી થાય ત્યારે સજદામાં જઈ સાત વખત "કુલ યા અય્યહુલ્ કાફેરુન"ની સૂરત પઢે અને તેનો સવાબ તમામ શોહદાએ કરબલાની રૂહે મુબારકને પહોંચાડે.

87

★ દુઆએ આશૂરા ★

આશૂરાના દિવસે ફજરની નમાઝ બાદ સૂર્ય ઊંચે ચઢયા બાદ બે રકાત નમાઝ પઢે, દરેક રકાતમાં સૂરએ ફાતિહા (અલ્હમ્દુ શરીફ) પછી કોઈ પણ સૂરત પઢે અને સલામ બાદ એક વાર આ દુઆ પઢો :-

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
يَا قَابِلُ تَوْبَةِ آدَمَ يَوْمَ عَاشُورَاءَ
يَا فَارِجَ كَرْبِ ذِي النَّوْنِ يَوْمَ عَاشُورَاءَ
يَا جَامِعَ شَمْلِ يَعْقُوبَ يَوْمَ عَاشُورَاءَ
يَا سَامِعَ دَعْوَةِ مُوسَى هَارُونَ يَوْمَ عَاشُورَاءَ
يَا مُجِيبَ دَعْوَةِ إِبْرَاهِيمَ مِنَ النَّارِ يَوْمَ عَاشُورَاءَ
يَا رَافِعَ إِدْرِيسَ إِلَى السَّمَاءِ يَوْمَ عَاشُورَاءَ
يَا مُجِيبَ دَعْوَةِ صَالِحٍ فِي النَّارِ يَوْمَ عَاشُورَاءَ

88

اللَّهُ السَّمَاءَاتِ كُلِّهَا نَسَعَكَ السَّلَامَةَ بِرَحْمَتِكَ
 يَا أَرْحَمَ الرَّاحِمِينَ وَهُوَ حَسْبُنَا وَنِعْمَ الْوَكِيلُ
 نِعْمَ الْمَوْلَى وَنِعْمَ النَّصِيرُ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا
 بِاللَّهِ الْعَلِيِّ الْعَظِيمِ وَصَلَّى اللَّهُ تَعَالَى عَلَى سَيِّدِنَا
 مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ وَعَلَى الْمُؤْمِنِينَ وَ
 الْمُؤْمِنَاتِ وَالْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ عَدَدَ دَرَجَاتِ
 الْوُجُودِ وَعَدَدِ مَعْلُومَاتِ اللَّهِ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

गिस्मिल्लाहिर्रह्मानिर्रहीम. या कागिल
 तौलति आदम यौम आशूराअ, या फ़ारिअ
 कर्गि ग्रीन्नूनि यौम आशूराअ, या ज़मिअ
 शब्लि यअकूज यौम आशूराअ, या सामिअ
 दअपति मूसा व हाइन यौम आशूराअ, या
 मुगीष धल्लाहीम मिन्नारि यौम आशूराअ,
 या राफ़िअ धद्रीस धलस्समाध यौम आशूराअ,
 या मुजुज दअपति सालिहिन फ़िन्नाकति

يَا تاجِرَ سَيِّدِ تَا مُحَمَّدٍ صَلَّى اللَّهُ تَعَالَى وَسَلَّمْ يَوْمَ عَاشُورَاءَ
 يَا رَحْمَنَ الدُّنْيَا وَالْآخِرَةِ وَرَحِمَهُمَا صِلْ عَلَيَّ
 سَيِّدِ تَا مُحَمَّدٍ وَعَلَى آلِ سَيِّدِ تَا مُحَمَّدٍ وَصَلِّ عَلَيَّ
 جَمِيعِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ وَأَقْبِضْ حَلْجَاتِنَا فِي الدُّنْيَا
 وَالْآخِرَةِ وَأَطْلِ عُمَرَ تَا فِي طَاعَتِكَ وَمَحَبَّتِكَ وَ
 رِضَاكَ وَأَخِيَّتَنَا حَيَوَةً طَيِّبَةً وَتَوْفِقًا عَلَيَّ الْإِيْمَانِ
 وَالْإِسْلَامِ بِرَحْمَتِكَ يَا أَرْحَمَ الرَّاحِمِينَ اللَّهُمَّ
 بَعِّثْ الْحَسَنَ وَأَخِيْبَهُ وَأُمِّهَ وَأَبِيْهَ وَحَدِيْهَ وَبَنِيْهَ
 كَرِيْمًا عَنَّا مَاتَحْنُ فِيْهِ

(-: ५९ सात वार पढे :-)
 مِنْ سُبْحَانَ اللَّهِ
 مِلَأَ الْمِيْزَانَ وَمُنْتَهَى الْعِلْمِ وَمَبْلَغِ الرِّضَى وَرِنَةَ
 الْعَرْشِ لَا مَلْجَأَ وَلَا مَنْجَاءَ مِنَ اللَّهِ إِلَّا إِلَيْهِ
 سُبْحَانَ اللَّهِ عَدَدَ الشُّعْرِ وَالْوَسْرِ وَعَدَدَ كَلِمَاتِ

यौम आशूराअ. या नासिर सैयिदिना
 मुहम्मदिन् सल्लल्लाहु अलैहि वसल्लम यौम
 आशूराअ. या रह्मान हुन्या वल्आभिरति
 व रहीमहुमा सल्लल्लाहु अला सैयिदिना
 मुहम्मदिप् व अला आलि सैयिदिना मुहम्मदिप्
 व सल्लिअला जमीधल् अंजियाध वल्लुर्सलीन
 वइदि हाजतिना फ़ीहुन्या वल्आभिरति व
 अतिल् उमरना फ़ी ताअतिक व महल्लतिक
 व रिदाक व अह्यिना हयातन् तेयिअतप्
 वतवइइना अलल् धमानि वल्लरलामि
 गिरहमतिक या अर्हमर्राहिमीन. अल्लाहुम्म
 गिधग्गिल् हसनि वअजीहि वउम्मिही व
 अजीहि वजदिही व अजीहि इर्रिअ अन्ना
 मा नह्लु फ़ीहि.

५९ सात वार पढे :-

सुल्लानल्लाहि मिल्लअल्मीग़ानि व
 मुन्तहल्लि वल्लग़रिदा वजिनतल् अशि

लामल्लअ वला मल्लअ मिनल्लाहि धल्ला
 धलेह. सुल्लानल्लाहि अदद इशक़्फ़ वल्लदि
 व अदद कलिमा तिल्लाहिताम्माति कुल्लिहा
 नरअलुक रसलामत गिरहमतिक या
 अर्हमर्राहिमीन. वहुव हरल्लुना व निअमल्
 वकील. निअमल् मौला व निअमन्नसीर. वला
 हौल वला कुव्वत धल्ला गिल्लाहिल् अलिख्यिल्
 अजीम. व सल्लल्लाहु तआला अला सैयिदिना
 मुहम्मदिप् व अला आलिही व सहगिही व
 अलल् मुअ्मिनीन वल्लुअ्मिनाति वल्लुस्लिमीन
 वल्लुस्लिमाति अदद ग़र्रातिल्लुवूदि व अदद
 मअ्लुमातिल्लाहि वल्लह्हुल्लिल्लाहि रज्जिल्
 आलमीन.

आ अमल करनारने अग़षित धिआहतनो
 सवाध मणशे.

आशूराना दिवसे कोधपण समये भावुजू थधने
 ७० वार पढे : हस्तिगुल्लाह व निअमल्वकील.
 गुनाडोनी माफ़ी माटे आ वजीफ़ो अइल्ल धे.

★ આશૂરાના દિવસના મુસ્તહબ કામો ★

(૧) રોઝો રાખવો (૨) સદકો કરવો (૩) નફલ નમાઝ પઢવી (૪) ૧૦૦ વખત કુલ્હુવલ્લાહ શરીફ પઢવું (૫) આલિમોની ઝિયારત કરવી (૬) યતીમોના માથા ઉપર હાથ ફેરવવો (૭) પોતાના બાલ-બચ્ચાંની ખાધા ખોરાકીમાં વધારો કરવો (૮) ગુસ્લ કરવું (૯) સુરમો લગાડવો (૧૦) નખ કાપવા (૧૧) બીમારોની ખબર કાઢવી (૧૨) દુશ્મનોથી મેળાપ કરવો (૧૩) આશૂરાની દુઆ પઢવી.

★ શબ્દે મેઝરાજતી ઈબાદત ★

કિતાબુલ અવરાદમાં લખ્યું છે કે, આ રાતમાં એટલે કે ૨૭ રજબુલ્ મુરજજબની રાતમાં :-

૧૨ રકાત નફલ : નમાઝ છ સલામથી પઢે, દરેક રકાતમાં "અલ્હમ્દુ" પછી સૂરએ ઈબ્લાસ (કુલ્હુવલ્લાહ) પાંચ વખત પઢે. ૧૨ રકાત પઢી

લીધા પછી "કલ્મએ તમજુદ", ઈસ્તિગફાર અને દુરૂદ શરીફ ૧૦૦-૧૦૦ વખત પઢીને જે દુઆ માંગશે તે કબૂલ થશે. ઈ-શાઅલ્લાહ !

૬-રકાત : (બે-બે કરીને) "અલ્હમ્દુ" પછી "સૂરએ ઈબ્લાસ" ૭ વાર પઢે. નમાઝ પઢ્યા પછી ૫૦ વાર દુરૂદ શરીફ પઢીને દુઆ કરે તો અલ્લાહ તઆલા તેની તમામ દીની દુનિયવી હાજતો પૂરી કરશે.

૧૦૦-રકાત : (૨-૨ કરીને) દરેક રકાતમાં "અલ્હમ્દુ" પછી એક વખત "સૂરએ ઈબ્લાસ" પઢે. નમાઝ પછી સો વાર દુરૂદ શરીફ પઢીને સિજદામાં માથુ રાખીને અલ્લાહ તઆલાથી પોતાની હાજત તલબ કરે. ઈ-શાઅલ્લાહ તેની હાજત પૂર્ણ થશે.

સાલેહ લોકોનો તરીકો : હુઝૂર અકરમ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)ને હદિયો મોકલવાની નિયતે નીચે પ્રમાણે પઢતા :-

૨-રકાત નમાઝ : દરેક રકાતમાં "અલ્હમ્દુ" પછી "સૂરએ ઈબ્લાસ" ૨૭ વખત અને કાએદામાં "અતહિવ્યાત" પછી દુરૂદે ઈબ્રાહીમ ૨૭ વખત પઢીને દુઆએ માપૂરહ પઢે. સલામ ફેરવ્યા બાદ તેનો હદિયો હુઝૂર (અલૈહિસ્સલાતુ વસ્સલામ)ના દરબારમાં પેશ કરવાની સઆદત હાંસલ કરી ભાગ્યવાન બનો. -(બહવાલા રહમતની રાતો)

★ ફઝાઈલે શાબાનુલ્ મોઝઝુમ ★

શાબાનના પૂરા મહિનાની ઘણી જ ફઝીલત છે. પણ ખાસ કરીને ૧૫ મી શાબાન અતિ ફઝીલતવાળી રાત છે. હદીષ શરીફમાં છે કે શાબાનની ૧૫ મી રાતમાં ખુદાએ ઝુલ જલાલ રહમત નાઝિલ ફર્માવે છે અને ફરિશ્તાઓ અલ્લાહ તઆલા સમક્ષ વર્ષભરનાં આમાલનામાં રજુ કરે છે. ત્યારબાદ અહુકમુલ્ હાકિમીન પોતાની રહમતથી બંદાઓને ધ્યારુ સંબોધન કરે છે : "ખબરદાર ! છે કોઈ મગફેરત માંગનાર કે હું

તેના ગુનાહોને બખ્શી દઉં. ખબરદાર ! છે કોઈ રોઝુ માંગનાર કે હું તેને રોઝુ આપુ. ખબરદાર ! છે કોઈ મુસીબતમાં સપડાયેલો કે હું તેને રાહત બખ્શું. ખબરદાર ! છે કોઈ આવો આવો.....(છેવટ સુધી).

હે ધ્યારા દીની ભાઈઓ તથા બહેનો ! શું તમે મગફેરત નથી ચાહતા ? શું રોઝુની તમને તલબ નથી ? શું તમારે મુસીબતો નથી દૂર કરવી ? તો આવો ! અને આજે આ રાતને હરવા ફરવા, ટોળે મળી ગપ્પાં હાંકવા કરતાં અલ્લાહની ઈબાદતમાં રાત ગુજારો.

★ શાબાનુલ્ મોઝઝુમના મશહૂર પ્રસંગો ★

આ મહીનાની પાંચ તારીખે સૈયેદેના હઝરત ઈમામ હુસૈન رضي الله عنه ની વિલાદતે મુબારકા થઈ.

આ મહીનાની પંદરમી તારીખ શબે બરાત છે એટલે કે મુસલમાન ઉમ્મતમાંથી ઘણી વ્યક્તિઓની મગફેરત થઈ જાય છે.

આ મહીનાની સોળમી તારીખે કા'બા શરીફને કિબ્લો બનાવવાનો હુકમ થયો. પહેલાં ઈસ્લામના પ્રારંભમાં કેટલાક અરસા સુધી બૈતુલ મુકદ્દસ કિબ્લો રહ્યો. અને પછી અલ્લાહે હુઝૂર સરાપા નૂર શાફએ યૌમુન્નુશૂર سلي الله تعالى عليه ની મરજીના પ્રમાણે કા'બા મોઅઝ્ઝમાને મુસલમાનોનો કિબ્લો બનાવી દીધો. ત્યારથી હવે હમેશાં માટે મુસલમાન કા'બા શરીફ તરફ મોઢું કરીને નમાઝ અદા કરતા રહેશે. (અજાઈબુલ મખ્લૂકાત, પૃષ્ઠ-૪૭)

★ શબ્દ બરાતના ગફલ ★

આ મુબારક રાત્રીએ ગુસલ કરે અને બે રકાત નમાઝ પઢે ઘણો જ સવાબ મળશે.

હુઝૂરે અકરમ سلي الله تعالى عليه એ ફર્માવ્યું છે કે, "જ્યારે શાબાનની ૧૫ મી રાત્રી હોય ત્યારે નવાફિલ પઢો અને ૧૫ મીના દિવસે રોઝો રાખો નિ:શંક ! તે રાત બરકતવાળી છે.

૧૪ મી શાબાનના ગુરૂબ આફતાબ

(સૂર્યાસ્ત)ના સમયે ૪૦ વાર "લા હૌલ વલા કુવ્વત ઇલ્લા બિલ્લા હિલ્ અલીય્હીલ્ અઝીમ" પઢે અને ૧૦૦ વાર દુરૂદ શરીફ પઢે.

★ દુઆએ ગિરફ શાબાન ★

શાબાનની ૧૫ મી રાત્રે મગરિબની નમાઝ બાદ છ રકાતો બબ્બે કરીને પઢે. પ્રથમ બે રકાત વખતે ભલાઈની સાથે લાંબી ઉમરની, બીજી બે રકાત વખતે બલાઓ દૂર થવાની, ત્રીજી બે રકાત મખ્લૂકનો મોહતાજ ન થવાની નિચ્યતથી પઢે, દરેક બે રકાત બાદ સૂરએ યાસીન એક વાર અથવા સૂરએ ઈખ્લાસ (કુલ્હુવલ્લાહ) ૨૧ વાર અને ત્યાર બાદ છેવટે દુઆએ ગિરફ શાબાનુલ્ મુઅઝ્ઝમ પઢે :-

اللَّهُمَّ يَا ذَا الْمَنِّ وَلَا يَمُنُّ عَلَيْكَ إِلَّا ذَا الْجَلَالِ
وَالْإِكْرَامِ يَا ذَا الطَّوْلِ وَالْإِعْظَامِ لَا إِلَهَ إِلَّا
أَنْتَ ظَهَرَ الْأَجْيُنُ وَالْجَارُ الْمُسْتَجِيرِينَ وَالْ

إِمَانِ الْعَالَمِينَ اللَّهُمَّ إِنْ كُنْتَ كَتَبْتَنِي عِنْدَكَ
فِي أُمَّ الْكِتَابِ شَقِيًّا أَوْ فَحْرًا أَوْ مَطْرُودًا أَوْ
مُقْتَرًا عَلَيَّ فِي الرِّزْقِ فَأَهْرُ اللَّهُمَّ بِفَضْلِكَ
شَقَاؤِي وَجُرْمِي وَطَرْدِي وَأَقْبِتَارِي وَأَنْبِيئِي
عِنْدَكَ فِي أُمَّ الْكِتَابِ سَعِيدًا أَمْرًا وَقَامُوقًا
لِلْخَيْرَاتِ فَإِنَّكَ قُلْتَ وَقَوْلِكَ الْحَقُّ طِبِّي كِتَابِكَ
الْمُنَزَّلَ عَلَى لِسَانِ نَبِيِّكَ الْمُرْسَلِ يَمْحُو اللَّهُ مَا
يَشَاءُ وَيُثَبِّتُ وَعِنْدَكَ أُمَّ الْكِتَابِ إِلَهِي بِالْحَقِّ
الْأَعْظَمِ فِي لَيْلَةِ التَّصْفِ مِنْ شَهْرِ سَعْيَانَ الْمَلَكُومِ
الَّتِي يُفْرَنُ فِيهَا كُلُّ أَمْرٍ كَبِيرٍ وَيَبْرُمُ أَنْ تَكْتَفِ
عَنَّا مِنَ الْبَسَاءِ وَالْبَلَاءِ مَا نَعْلَمُ وَمَا لَا نَعْلَمُ
وَأَنْتَ بِهِ أَعْلَمُ إِنَّكَ أَنْتَ الْأَعَزُّ الْأَكْرَمُ وَصَلَّى اللَّهُ
تَعَالَى عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ وَسَلَّمَ
وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

અલ્લાહુમ્મ યા ઝલ્ મન્નિ વલાયુમન્નુ અલૈહિ. યા ઝલ્ જલાલિ વલ્ ઈકરામ. યા ઝત્તૌલિ વલ્ઈન્આમિ લાઈલાહ ઈલ્લા અન્ત ઝહરલ્લાહુન. વખરલ્ મુસ્તજુરીન, વ અમાનલ્ ખાઈફીન. અલ્લાહુમ્મ ઈન્કુન્ત કતબતની ઈન્દક ફી ઉમ્મિલ્કિતાબિ શકિરચન્ અવ્ મહરમન્ અવ્ મતરદન્ અવ્ મુકતરન્ અલૈય ફિરિર્મ્કિ ફમ્હુ. અલ્લાહુમ્મ બિ ફદલિક શકાવતી વહિર્માની વતદૌ વકતિતાર રિર્મ્કી. વ અખિલ્ની ઈન્દક ફી ઉમ્મિલ્ કિતાબિ સઈદમ્ મર્મુકમ્ મુવફ્ફલ્ લિલ્ ખેરાતિ. ફઈન્નક કુલ્ત વકોલુલ્લહ્ક. ફી કિતાબિકલ્મુન્નલ. અલા લિસાનિ નબિય્ચિકલ્ મુર્સલ. ચમ્હુલ્લાહુ મા ચશાઉ વયુખિતુ વઈન્દહ્ ઉમ્મુલ કિતાબ. ઈલાહી બિતજલ્લીલ્ અઝ્ઝમ. ફી લૈલતિન્નિસ્ફિ મિન્શહરિ શાબાનિલ્ મુકર્રમ. અલ્લતી ચુફરકુ ફીહા કુલ્લુ અમ્રિન્ હકીમિવ્ વ ચુબરમ. અન્તકશિફ અન્ના મિનલ્ બલાઈ વલ્બલ્વાઈ

મા નઅલમુ વમા લા નઅલમ. વ અન્ત઼િહી અઅલમુ ઈન્નક અન્તલ્ અઅમ્મુલ્ અકરમ. વ સલ્લલ્લાહુ તઆલા અલા સૈયિદિના મુહમ્મદિવ્ વઅલા આલિહી વસહ઼્િહી વસલ્લમ. વલ્હમ્દુલિલ્લાહિ ર઼િ઼િલ્ આલમીન.

ઈશાની નમાઝ બાદ : આઠ રકાત નફ્લ નમાઝ બે-બે રકાતની નિચ્ચતથી અદા કરે. દરેક રકાતમાં અલ્હમ્દુ પછી "સૂરએ કુલ્લુવલ્લાહુ અલ્હ" પાંચ વખત પઢે. આ નમાઝ પઢનાર ગુનાહોથી પાક સાફ થશે અને તેની દુઆઓ કબૂલ થશે તેમ જ ઘણો મોટો સવાબ પ્રાપ્ત થશે.

ચાર રકાત એક સલામથી પઢે : દરેક રકાતમાં અલ્હમ્દુ પછી સૂરએ ઈબ્લાસ (કુલ્લુવલ્લાહ) ૫૦ વાર પઢે.

બે રકાત નમાઝ પઢે : દરેક રકાતમાં અલ્હમ્દુ પછી આયતુલ કુર્સી એકવાર અને સૂરએ ઈબ્લાસ ૧૫ વાર પઢે. સલામ ફેરવ્યા પછી ૧૦૦

વાર દુરૂદ શરીફ પઢે. આ નમાઝ પઢવાવાળાની રોઝીમાં બરકત થશે તેમજ દુઃખ દર્દથી રક્ષણ મળશે અને ગુનાહોથી બખ્શિશ થશે.

૧૪ રકાત નમાઝ : બે-બે રકાતની નિચ્ચતથી પઢે. નમાઝ પૂરી કર્યા પછી ૧૦૦ વાર દુરૂદ શરીફ પઢે અને દુઆ માંગે. ઈન્શાઅલ્લાહ ! કબૂલ થશે.

૧૦૦ રકાત નમાઝ : આ મુબારક રાત્રીએ બે-બે રકાતની નિચ્ચતથી ૧૦૦ રકાત નફ્લ નમાઝ પઢે જેમાં સૂરએ ફાતેહા (અલહમ્દો) પછી સૂરએ ઈબ્લાસ (કુલ્લુવલ્લાહ) ૧૦ વાર પઢે. આ નમાઝને "સલાતુલ ખૈર" કહે છે.

આ નમાઝ બાબત ખ્વાજા હસન બસરી رحمۃ اللہ علیہ એ રિવાયત કરી છે કે, ત્રીસ સહાબીઓએ મને કહ્યું કે, "જે વ્યક્તિ આ નમાઝને આ રાતમાં પઢશે અલ્લાહ તઆલા તેની તરફ ૭૦ વખત નિહાળશે અને દરેક નઝરના બદલામાં તેની ૭૦ હાજતો પૂરી

કરશે જેમાં બધાથી ઉત્તમ મગફેરત છે. (ઈન્શાઅલ્લાહ ! સુબ્હાનલ્લાહ !)

રમઝાન શરીફની ૨૭ મી રાત ચા'ને "શબે કદ્રના ફઝાઈલ તથા નવાફિલ"

પ્યારા સુન્ની ભાઈઓ તથા બહેનો ! આ મુબારક રાતને ખેલ તમાશા, ખોટા ઉજાગરા કરીને વેડફશો નહીં, તેની ઘણી જ ફઝીલતો છે. ટૂંકમાં અહીં નિર્દેશ કરીએ છીએ. તે મેહરૂમ જ રહેશે જે આ રાતની કદર ન કરે.

કુર્આને પાકમાં છે : (તર્જુમો) : બેશક ! અમે એને શબે કદ્રમાં ઉતાર્યું અને તમે શું જાણ્યું શું શબે કદ્ર ?! શબે કદ્ર હજાર મહીનાઓથી બેહતર (છે) એમાં ફરિશતા અને જિબ્રઈલ ઉતરે છે પોતાના રબના હુકમથી દરેક કામના માટે, તે સલામતીને સવાર ચમકતાં સુધી. (સૂરએ કદ્ર)

હદીષ શરીફમાં છે : એક વખત હુઝૂરે અકરમ નૂરે મુજસ્સમ صلی اللہ تعالیٰ علیہ وسلم એ બની ઈસ્રાઈલના

શમ્ઝિન નામી એક વલીની ઈબાદતનું વર્ણન કર્યું કે, તે હજાર મહીના સુધી રોઝા રાખતા, રાત ભર ખુદાની ઈબાદત તથા નમાઝમાં વ્યસ્ત રહેતા અને દિવસે શસ્ત્રોથી સજ્જને જેહાદ કરતા.. વગેરે. સહાબાએ હુઝૂર صلی اللہ تعالیٰ علیہ وسلم ની બારગાહમાં અર્ઝ કરી કે, યા રસૂલલ્લાહ ! અમે તો કદાપિ તેમની ઈબાદતને પહોંચી શકીશું જ નહીં કેમ કે અમારી ઉમરો તો એટલી લાંબી છે જ નથી ! સહાબાએ કિરામની આ હસરતઅંગેઝ આરઝૂ પર રબ તઆલાએ શબે કદ્ર જેવી બરકતી રાત અતા કરી કે આ રાતની ઈબાદત હઝરત શમ્ઝિનની હજાર મહીનાઓની ઈબાદતથી બેહતર છે. (સુબ્હાનલ્લાહ !)

જેણે શબે કદ્રની રાતમાં ત્રણવાર લાઈલાહ ઈલ્લલ્લાહ મુહમ્મદુર્સૂલુલ્લાહ صلی اللہ تعالیٰ علیہ وسلم પઢ્યું તો પ્રથમ વાર પઢવાથી રબ તઆલા તેની મગફેરત ફર્માવી આપે છે, બીજીવાર પઢવાથી જહન્નમથી

આઝાદ ફર્માવી દે છે અને ત્રીજીવાર પઢવાથી જન્નતમાં દાખલ ફર્માવે છે. (દુરતુન્નાસિહીન)

શબે કદ્રમાં આસ્માનના દરવાજા ખોલી દેવામાં આવે છે. જે બંદો એમાં નમાઝ પઢે છે તો અલ્લાહ તઆલા તેની એક એક તકબીર (અલ્લાહુ અકબર)ના બદલામાં જન્નતમાં એવું સાયાદાર ઝાડ અતા કરે છે કે તેની નીચે ચાલનાર ૧૦૦ વરસ ચાલે છતાં તેનો સાયો પૂરો થશે નહીં. અને દરેક રકાતના બદલામાં જન્નતમાં એક મકાન મોતીઓ, યાકૂત, ઝબરજદ અને લૂઅૂ લૂઅૂ (ના પથ્થરો)નું અતા કરશે. દરેક સલામ ફેરવવાના બદલામાં જન્નતી ચાદરોમાંથી એક ચાદર અતા કરશે. (દુરતુન્નાસિહીન)

આ રાત્રે નમાઝની નિચ્યતે ગુસ્લ કરશે તેના તમામ ગુનાહ માફ થશે, પગો ધોતાં પહેલાં.

રાત્રે જાગી ઈબાદત કરનારને ૨૭ હજાર સાલનો સવાબ મળશે તથા કબ્ર નૂરથી રોશન થશે.

૭ વાર સૂરએ કદ્ર પઢે તો ૭૦ હજાર ફરિશ્તા તેના માટે જન્નતની દુઆ કરશે.

★ ગફલ નમાઝો ★

૪ રકાત નમાઝ : દરેક રકાતમાં 'અલ્હમ્દુ' પછી 'ઈન્ના અન્નલ્ના' ત્રણ વાર અને 'કુલ્ હુવલ્લાહ' ૫૦ વાર. સલામ ફેરવ્યા બાદ સજદામાં જઈને ૧ વાર "સુબ્હાનલ્લાહિ વલ્હમ્દુલિલ્લાહિ વલા ઈલાહ ઈલ્લલ્લાહુ અલ્લાહુ અકબર" પઢી જે દુઆ માંગશે તે કબૂલ થશે, ઈન્શાઅલ્લાહ.

૪ રકાત નમાઝ : દરેક રકાતમાં 'અલ્હમ્દુ' પછી ૧ વાર 'ઈન્ના અન્નલ્ના' અને ૨૭ વાર 'કુલ્હુવલ્લાહ' પઢે તો તે શપ્સ ગુનાહોથી એવો પાક થશે જાણે કે આજે જ પેદા થયો અને તેને ૨૭ તઆલા જન્નતમાં હજાર મહેલ અતા કરશે.

૨ રકાત નમાઝ : બંનેમાં 'અલ્હમ્દુ' પછી 'ઈન્ના અન્નલ્ના' ૧ વાર અને 'કુલ્હુવલ્લાહ' ૩

વાર પઢે તો અલ્લાહ તઆલા તેને શબે કદ્રનો સવાબ અતા કરશે અને તેના રોઝા કુબૂલ ફર્માવશે.

૪ રકાત નમાઝ :: દરેકમાં 'અલ્હમ્દુ' પછી ૩ વાર 'ઈન્ના અન્નલ્ના' અને ૧૭ વાર 'કુલ્હુવલ્લાહ' પઢે. તેની ૨૭ તઆલા મરતી વેળા સકરાત આસાન ફર્માવશે અને કબ્રનો અઝાબ દૂર કરશે.

૨ રકાત નમાઝ : દરેકમાં 'અલ્હમ્દુ' પછી 'ઈન્ના અન્નલ્ના' ૭ વાર અને ૭ વાર 'કુલ્હુવલ્લાહ' પઢે. નમાઝ પૂરી કરીને ઈસ્તિગ્ફાર અને દુરૂદ ૧૦૦ વાર પઢે. ૨૭ તઆલા આ પઢનારને તથા તેનાં મા બાપને બખ્શી આપશે.

૪ રકાત નમાઝ : દરેકમાં 'અલ્હમ્દુ' પછી 'અલ્હાકુમુત્તકાસુર' ૧ વાર અને ૩ વાર 'કુલ્હુવલ્લાહ' પઢે તો આ નમાઝ પઢનાર પર મૌતની સખ્તી આસાન થશે અને જન્નતમાં ચાર સુતૂન મળશે અને દરેક સુતૂન પર હજાર મહેલ હશે. (ગુન્યતુત્તાલિબીન)

હઝરત અલી رضي الله عنه ફર્માવે છે : જે શબે કદ્રમાં ઈશાની નમાઝ બાદ ૭ વાર 'ઈન્ના અન્નલ્ના' પઢશે તો દરેક મુસીબતથી નજાત મળશે અને હજાર ફરિશ્તા તેના માટે જન્નતની દુઆ કરશે.

શબે કદ્રમાં સુબ્હ સાદિકની નજીક ૪ રકાત એક સલામથી પઢે. દરેક રકાતમાં 'અલ્હમ્દુ' પછી ૩ વાર 'ઈન્ના અન્નલ્ના' અને ૫ વાર 'કુલ્હુવલ્લાહ' પઢે. નમાઝ પૂરી કરીને સજદામાં જઈ ૪૧ વાર 'સુબ્હાનલ્લાહ' પઢે તેની તમામ હાજતો પૂરી થશે.

આ રાતમાં સલાતુત્તરબીહ જરૂર પઢે, કબ્રસ્તાન જાય, તથા મીઠી ચીજ પર હુઝૂર صلی الله تعالی علیه وسلم તથા તમામ મુસલમાનોના નામે ફાતેહા કરે અને આ દુઆ કસરતથી પઢે :-

અલ્લાહુમ્મ ઈન્નક અકુલ્લુન કરીમુન તુહિબ્બુલ અફ્વ ફઅ્ફુ અન્ની.



★ શજરએ હઝરાતે આલિયા કાદરિયા

બરકાતિયા رَضَوَانَ اللّٰهُ تَعَالٰى عَلَيْهِمْ رَحْمَةً

યા ઈલાહી ! રહમ ફર્મા મુસ્તફા કે વાસ્તે,
યા રસૂલલ્લાહ ! કરમ કીજીએ ખુદા કે વાસ્તે
મુશિકલે હલ કર, શહે મુશિકલ કુશા કે વાસ્તે,
કર બલાએ રદ, શહીદે કરબલા કે વાસ્તે
સય્યદે સજજાદ કે સદકે મેં સાજિદ રખ મુજે,
ઈલ્મે હક્ક દે બાકિરે ઈલ્મે હુદા કે વાસ્તે
સિદ્દકે સાદિકકા તસદુક સાદિકુલ ઈસ્લામ કર,
બે ગઝબ રાઝી હો, 'કાઝિમ' ઔર 'રઝા' કે વાસ્તે
બેહરે મઅરૂફો સરી, મઅરૂફ દે બે ખૂદ સરી,
જુદે હક્કમેં ગિન જુનેદે બા સફા કે વાસ્તે
બેહરે શિબ્લી શેરે હક્ક, દુન્યા કે કુત્તોસે બયા,
એક કા રખ અબ્દે વાહિદ બે રિયા કે વાસ્તે
બુલ-ફરહ કા સદકા કર ગમકો ફરહા દે હુસ્નો સઅદ,
બુલ હસન ઔર બૂ સઈદે સાઅદઝા કે વાસ્તે
કાદરી કર કાદરી રખ, કાદરીયોં મેં ઉઠા,
કદરે અબ્દુલ કાદિરે કુદરત નુમા કે વાસ્તે

અહસનલ્લાહો-લહુ રિઝ્કન સે દે કે રિઝ્કે હસન,
બન્દે એ રઝ્કાક તાજુલ અસ્ફિયા કે વાસ્તે
નસ્ર અબી સાલેહ કા સદકા સાલેહો મ-સૂર રખ,
દે હયાતે દી મુહિયે જાં ફિઝા કે વાસ્તે
તૂરે ઈરફાનો ઉલુવો હમ્દો હુસ્નો બહા,
દે અલી મૂસા હસન અહમદ બહા કે વાસ્તે
બેહરે ઈબ્રાહીમ મુજ પર, નારે ગમ ગુલઝાર કર,
ભીક દે દાતા ભિકારી બાદશાહ કે વાસ્તે
ખાન એ દિલ કો ઝિયા દે, રૂએ ઈમાં કો જમાલ,
શહે ઝિયા મૌલા જમાલુલ્ ઔલિયા કે વાસ્તે
દે મુહમ્મદ કે લિયે રોઝી કર અહમદ કે લિયે,
ખ્વાને ફઝ્લુલ્લાહ સે હિસ્સા ગદા કે વાસ્તે
દીનો-દુન્યા કી મુજે બરકાત દે બરકાત સે,
ઈશકે હક્ક દે ઈશકા એ-ઈશક ઈન્તેમા કે વાસ્તે
હુબ્બે એહલે બયત દે આલે મુહમ્મદ કે લિયે,
કર શહીદે ઈશકે હમ્ઝા પેશવા કે વાસ્તે
દિલ કો અચ્છા તન કો સુથરા જાન કો પુરનૂર કર,
અચ્છે પ્યારે શમ્સે-દી બદરુલ્ ઉલા કે વાસ્તે

દો જહાં મેં બાદિમે આલે રસૂલુલ્લાહ કર,
હઝરતે આલે રસૂલે મુક્તદા કે વાસ્તે
નૂરે જાનો, નૂરે ઈમાં, નૂરે કબ્રો હશ્ર દે,
બુલ હુસૈને અહમદે નૂરે લકા કે વાસ્તે
કર અતા અહમદ રઝા એ અહમદે મુરસલ મુજે,
મેરે મૌલા હઝરતે અહમદ રઝા કે વાસ્તે
સાયએ જુમલા મશાઈખ યા ખુદા હમ પર રહે,
રહમ ફર્મા આલે રહમાન મુસ્તફા કે વાસ્તે
સદકા ઈન આયાંકા દે, છે અયન ઈઝ ઈલ્મો અમલ,
અફવો-ઈર્ફા આફિયત ઈસ બે નવા કે વાસ્તે

★ આ'લા હઝરત رَضِيَ اللهُ عَنْهُم كِي دُؤَا ★

યા ઈલાહી ! હર જગહ તેરી અતાકા સાથ હો
જબ પળે મુશિકલ શહે મુશિકલ કુશાકા સાથ હો
યા ઈલાહી ! ભૂલ જાઉં નઝઅ કી તકલીફ કો
શાદી એ દીદારે હુસ્ને મુસ્તફાકા સાથ હો
યા ઈલાહી ! ગોરે તિરાહ કી જબ આએ સખ્ત રાત
ઉનકે પ્યારે મુંહકી સુબહે જાં ફિઝા સાથ હો

યા ઈલાહી ! જબ પળે મહશરમેં શૌરે દારોગીર
અમ્ન દેનેવાલે પ્યારે પેશવા કા સાથ હો
યા ઈલાહી ! જબ ઝબાને બાહર આએ પ્યાસ સે
સાહિબે કૌષર શહે જૂદો અતાકા સાથ હો
યા ઈલાહી ! ગર્મીએ મેહશર સે જબ ભળકે બદન
દામને મહબૂબ કી ઠંડી હવાકા સાથ હો
યા ઈલાહી ! નામએ આમાલ જબ ખુલને લગે
એબ પોશે બલક સત્તારે ખતાકા સાથ હો
યા ઈલાહી ! રંગ લાએ જબ મેરી બે બાકિયાં
ઈનકી નીચી નીચી નઝરોંકી હયાકા સાથ હો
યા ઈલાહી ! જબ ચલૂં તારિક રાહે પુલસિરાત
આફતાબે હાશમી નૂરુલ્ હુદાકા સાથ હો
યા ઈલાહી ! જબ સરે શમશીર પર ચલના પળે
રબ્બે સલ્લિમ કેહનેવાલે ગમ જુદા કા સાથ હો
યા ઈલાહી ! જો દુઆએ નેક હમ તુઝસે કરે
કુદ્દસિયોંકે લબસે આમીન રબ્બના કા સાથ હો
યા ઈલાહી ! જબ 'રઝા' ખ્વાબે ગિરાં સે સર ઉઠાએ
દૌલતે બેદાર ઈશકે મુસ્તફા કા સાથ હો